

September 7, 2023

To,

### National Stock Exchange of India Ltd.

Exchange Plaza Bldg. 5th Floor, Plot No.C-1 'G' Block, Near Wockhardt, Bandra Kurla Complex, Mumbai 400 051.

Fax:26598237/38 Symbol: DCW

Dear Sir/Madam,

### **BSE Limited**

Department of Corporate Services, 1st floor, New Trading Ring Rotunda Building, Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai - 400 001. Fax: 22723121/3719/2037/2039

Fax: 22723121/3719/2037/2039

Scrip Code: 500117

Sub.: Disclosure under the Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 - Newspapers advertisements regarding 84th Annual General Meeting of the Company

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith advertisements published in the "Business Standard" (English Edition) and "Financial Express" (Gujarati Edition) as required under the provisions of Sections 101 and 108 of the Companies Act, 2013 ("Act") read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, and the other applicable provisions of the Act, Rules made thereunder, and relevant Circulars issued by the Ministry of Corporate Affairs confirming about the dispatch of Notice of Annual General Meeting and Annual Report for the Financial Year 2022-23 to the Members through email and inter alia informing about the:

 84th Annual General Meeting ("AGM") of the Members of the DCW Limited ("the Company") to be held on Friday, September 29, 2023 at 12:00 noon (IST) through Video Conferencing ("VC") or Other Audio Visual Means ("OAVM"); and

### **DCW LIMITED**

**HEAD OFFICE:** 

"NIRMAL" 3RD FLOOR, NARIMAN POINT, MUMBAI-400 021. TEL.: 2287 1914, 2287 1916, 2202 0743 TELEFAX: 22 2202 8838 REGISTERED OFFICE: DHRANGADHRA - 363 315 (GUJRAT STATE)

Email: ho@dcwltd.com, Website: www.dcwltd.com, CIN-L24110GJ1939PLC000748



2) Remote e-voting facility offered to the Members of the Company

The information is also being uploaded on the Company's website at www.dcwltd.com.

You are requested to take the aforesaid information on your record.

Thanking You,

Yours faithfully,

For DCW Limited

Dilip Darji

Sr. General Manager (Legal) & Company Secretary Membership No. ACS-22527

Encl:A/a

REGISTERED OFFICE: DHRANGADHRA - 363 315 (GUJRAT STATE)

Email: ho@dcwltd.com, Website: www.dcwltd.com, CIN-L24110GJ1939PLC000748

### DYNAMIC ARCHISTRUCTURES LIMITED

CIN - L45201WB1996PLC077451

Regd Off: 409, Swaika Centre, 4A, Pollock Street, Kolkata (W.B.) 700 001, Ph: 033-22342673

Website: www.dynamicarchistructures.com | Email: info@dynamicarchistructures.com

NOTICE OF THE 27<sup>th</sup> ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING AND BOOK CLOSURE Notice is hereby given that the 27th Annual General Meeting ("AGM") of the members of the Company will be held on Saturday. September 30, 2023 at 12,00 p.m. at the registered office of the Company at 409, Swaika Centre, 4A Pollock Street, Kolkata, West Bengal 70001 in compliance with the applicable provisions of the Companies Act, 2013 ('the Act') and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('SEBI (LODR) Regulations') to ransact the businesses as set forth in the Notice of the AGM.

The Company has sent the Annual Report of the Company for the Financial Year 2022-23 along

with the Notice of the 27° AGM and remote e-voting procedure on September 06, 2023 through electronic means to Members whose email addresses were registered with the Company. Depositories and holding shares as on September 05, 2023. A physical copy of the aforesaid documents will be sent to those members who request for the same at info@dynamicarchistructures.com mentioning their DP ID/ and Client ID. These documents are also available on the website of the Company www.dynamicarchistructures.com and the website of the Stock Exchange i.e. BSE Limited at www.bseindia.com, and also on the website of NSDL at www.evoting@nsdl.co.in.

Notice is further given pursuant to Section 91 of 'the Act' read with the Companies (Managemen and Administration) Rules, 2014 and Regulation 42 of the SEBI (LODR) Regulations, that the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Saturday September, 2023 to Friday, 29th September, 2023 (Both Days Inclusive) for the purpose of the

23<sup>rd</sup> September, 2023 to Fin 27<sup>th</sup> AGM of the Company. 27 As Morth (Education 108 of the Act' read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, and Regulation 44 of the SEBI (LODR) Regulations, and Secretaries of India on General Meetings (SS-2) issued by the institute of Company Secretaries of India, the Company is providing its members facility to exercise their right to vote through electronic means through remote e-voting services of National Securities Depository Limited ("NSDL"). The details

- oursuant to act are as under: . The remote e-voting will commence on Monday, 25th September, 2023 at 9.00 a.m. and end or Friday, 29th September, 2023 at 5.00 p.m.
- Members holding shares either in physical form or in dematerialisation form, as on cut—off date i.e. 23° September, 2023 shall be entitled to avail the facility of remote e-voting or voting at the AGM:
- 3. The remote e-voting module shall be disabled for voting thereafter and shall not be allo beyond Friday, 29th September 2023 at 5.00 p.m. and once the vote on a resolution is cast by
- member, he/she shall not be allowed to change it subsequently or cast the vote again;
  . The voting rights of the Members shall be in proportion to their shares in the paid up equity
- share capital of the Company as on the cut-off date Saturday, 23" September, 2023; b. Members who are holding shares in physical form or who have not registered their emai address with the Company / Depository or any person who acquires shares of the Company and becomes a Member of the Company after the Notice has been sent electronically by the Company, and holds shares as on the cut-off date, i.e. Saturday, 23<sup>rd</sup> September 2023, such member may obtain the User ID and password by sending request at evoting@nsdl.co.in. However, if a member is already registered with NSDL for e-voting then existing User ID and password can be used for casting vote.
- . Ballot papers shall be made available for voting at the venue of the AGM. Members attending the Meeting who have not cast their vote by remote e-voting shall be able to exercise their right at the meeting. Members who have voted through remote e- voting can attend/participate in the AGM but shall not be allowed to cast their vote again at the AGM.

In case of any queries/grievances/assistance required relating to e-voting, the Members may contact NSDL on evoting@nsdl.co.in / 1800-222-990 or contact Mr. Anubhav Saxena, Assistant Manager-NSDL at AnubhavS@nsdl.co.in / 022-24994835.

Place: Kolkata

Rakesh Porwal Director (DIN: 00495444)



CIN: L17100MH1946PLC004886 Regd. Office: Nesco Center, Western Express Highway, Goregoon (East), Mumbai 400063.

Tel: 022 66450123 • Email: companysecretary@nesco.in • Web: www.nesco.in

### NOTICE TO MEMBERS

Members are hereby informed that pursuant to Section 110 and 108 of the Companies Act, 2013 ("the Act") read with Rule 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014 and the General Circulars issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") from time to time, approval of the Members is being sought for the following Special Resolutions by way of Postal Ballot through only remote e-voting process ("e-voting")

- . Appointment of Mr. Manu Mahmud Parpia (DIN:00118333) as an Independent Directo of the Company.
- Appointment of Dr. Ramakrishnan Ramamurthi (DIN:00120246) as an Independent Director of the Company.
- 3. Appointment of Mr. Manish Ishwarlal Panchal (DIN:08431492) as an Independer Director of the Company.

In accordance with the MCA Circulars, the Company has completed the dispatch of the Postal Ballot Notice ("Notice") dated 4" August 2023 on 6" September 2023 only through electronic mode to those Members whose e-mail ids were registered with the Company/the Depositories and whose names appeared in the Register of Members/list of beneficial owners maintained by the Company/Depository as on **Friday**, **1"September 2023** i.e. the "Cut-off date". Voting rights shall be reckoned on the paid-up value of equity shares registered in the name of Members as of the Cut-off date. Any person who is not a Member as of the Cut-off date should treat this Notice for information purposes only.

The Company has appointed National Securities Depository Limited ("NSDL") as the agency for providing the e-voting facility. Notice is available on the Company's website i.e www.nesco.in and the websites of Stock Exchanges i.e. BSE Limited ('BSE') and the National Stock Exchange of India Limited ('NSE') at <a href="https://www.bseindia.com">www.bseindia.com</a> and www.nseindia.com respectively and on the website of National Securities Depositories Limited ('NSDL') i.e. www.evoting.nsdl.com.

The remote e-voting shall commence on Friday, 8th September 2023 (9:00 am IST) and ends on Saturday, 7th October 2023 (5:00 pm IST). The remote e-voting module shall be disabled by NSDL after 5:00 pm (IST) on Saturday, 7th October 2023. Any response received from the Members after the closing of working hours i.e., 5:00 pm. (IST) on Saturday, 7th October 2023 will not be valid. The voting rights shall be reckoned on the paid-up value of shares registered in the name of the Member as on the Cut-off Date. Once vote on a resolution is cast by a Member, the Member shall not be allowed to change it subsequently. The detailed procedure and instructions for remote e-voting is given in the

The Company has appointed Ms. Neeta H. Desai (Membership No. 3262, CoP No. 4741) of ND & Associates, Practicing Company Secretaries, as the Scrutinizer to scrutinize the Postal Ballot process in a fair and transparent manner. The Scrutinizer's decision on the validity of e-voting will be final

The results of the Postal Ballot would be announced by the Chairman of the Company or any other person authorized by him on or before Monday, 9th October 2023 at 5:00 p.m (IST) at the registered office of the Company and will be communicated on the same day to the Stock Exchanges, Depository, Registrar and Share Transfer Agents, and shall also be displayed on the Company's website.

In case of queries related to remote e-voting, Members may refer to Frequently Asked Questions (\*FAQs\*) and e-voting user manual for shareholders available at the downloads section of <a href="https://www.evoting.nsdl.com">www.evoting.nsdl.com</a> or contact Mr. Anubhav Saxena, Deputy Manager, NSDL, 4th Floor, A Wing, Trade World, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai 400013; Email: <a href="mailto:evoting@nsdl.co.in">evoting@nsdl.co.in</a>; Telephone No. 022-48867000/022-24997000 or write to the Company at <a href="mailto:companysecretary@nesco.in">companysecretary@nesco.in</a>.

Krishna S. Patel Mumbai Chairman & Managing Director DIN: 01519572 7<sup>th</sup> September, 2023

### **PUBLIC NOTICE**

This is to bring to the attention of the stakeholders of the Company (CIN: U17110MH2000PLC123731) and public that the name of the Company stands changed from 'Reliance Retail Finance Limited' to 'Jio Finance Limited' with effect from August 25, 2023. The said change has been made effective after obtaining approval of the Reserve Bank of India and the Registrar of Companies, Mumbai. The Company is a non-deposit taking systemically important non-banking financial company registered with the Reserve Bank of India.

> For Jio Finance Limited V. Mohana Company Secretary

Date: 06.09.2023



### DCW LIMITED

CIN: L24110GJ1939PLC000748 Regd. Office: Dhrangadhra - 363 315, Gujarat State Head Office: 3rd Floor, Nirmal, Nariman Point, Mumbai - 40002 Tel: 022-22871914 | Fax: 022-22028839 Website: www.dcwltd.com E-Mail: legal@dcwltd.com

NOTICE OF THE EIGHTY FOURTH (84TH) ANNUAL GENERAL MEETING AND E-VOTING

NOTICE is hereby given that the Eighty Fourth (84th) Annual General Meeting ("AGM") of the members of DCW Limited ("the Company") will be held on Friday, September 29, 2023 at 12:00 Noon (IST) through Video Conference (VC) / Other Audio-Visual Means (OAVM) without the physical presence of the Members at a common venue, in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the Rules made thereunder and the SEBI (Listing Obligations and Disclosur Requirements) Regulations, 2015 ("Listing Regulations") and in compliance with Circulars issued b the Ministry of Corporate Affairs vide General Circular No. 20/2020 dated May 5, 2020 read with General Circular No. 02/2021 dated January 13, 2021, General Circular No. 17/2020 dated April 13, 2020, General Circular No. 02/2022 dated May 5, 2022 and Circular No. 02/2021 dated January 13, 2021, General Circular No. 02/2022 dated May 5, 2022 and General Circular No. 10/2022 dated December 28, 2022 (collectively referred to as "MCA Circulars") and Securities and Exchange Board of India ("SEBI") vide its circular no. SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated January 5, 2023 (hereinafter referred to as "SEBI Circular") to transact business(es) as detailed in the Notice dated August 14, 2023.

In accordance with the MCA Circulars and SEBI Circular, the Notice of the AGM setting out the Ordinar and Special Business to be transacted at the AGM and the explanatory statement thereto along with the Annual Report of the Company for the Financial Year ended on March 31, 2023 which, inter-alia, comprises the Financial Statements of the Company for the Financial Year ended March 31, 2023 and Report of the Board of Directors and Auditors Report thereon, have been sent electronically or Wednesday, September 6, 2023 to the Members whose e-mail addresses are registered with Deposition Participant(s)/the Company/Bigshare Services Private Limited (Registrar and Share Transfer agen ("RTA") and are holding shares of the Company as on Friday, September 1, 2023 being the cut-off date for the purpose. In Compliance with the above circulars, the Company will not be dispatching physical copy of the Notice of the AGM and Annual Report for the Financial Year 2022-23 to any Member.

A copy of the Notice of AGM and the Annual Report is available on the website of the Company https://dcwltd.com/wp-content/uploads/2023/09/DCW-Annual-Report-2022-23.pdf and on the website of Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and also on the website of National Securities Depository Limited (NSDL) at https://evoting.nsdl.com.

The Company has fixed Friday, September 22, 2023 as the Record Date to determine the Member entitled to receive the proposed Dividend of Rs. 0.30/- (Thirty Paise) per share of face value Rs. 2/ each for the financial year ended March 31, 2023, if declared by the Members at the ensuing AGM. The Members may note that the Register of Members and Share Transfer Books of the Company shall

remain closed from Saturday, September 23, 2023 to Friday, September 29, 2023 (both days inclusive) In compliance with the provision of Section 108 of the Act read with Rule 20 of the Companie (Management and Administration) Rules, 2014 and Regulation 44 of Listing Regulations, the Members are provided with the facility to cast their vote remotely on all resolutions set-forth in this notice through electronic voting of platform National Securities Depository Limited ("NSDL") ("Remote e-voting") an also through e-voting at the AGM.

The remote e-voting will commence on Tuesday, September, 26, 2023 at 9.00 a. m. (IST) and will end on Thursday, September 28, 2023 at 5:00 p.m. (IST) and thereafter the remote e-voting module shall be disabled/blocked. The remote e-voting will not be allowed beyond the aforesaid date and time Once the vote on a resolution stated in the AGM Notice is cast by a member through remote e-voting the member shall not be allowed to change it subsequently and such vote which has been cast using remote e-voting shall be treated as final.

Members attending the AGM who have not already cast their votes by remote e-voting and are otherwise not barred from doing so, will be able to cast their vote electronically during the AGM. The Members may participate in the AGM even after exercising their rights to vote through remote e-voting but shall not be allowed to vote again during the AGM. A person whose name is recorded in the Register c Members or in the Register of Beneficial Owners maintained by the depositories as on **Friday, Septembe** 22, 2023 (the cut-off date) shall be entitled to cast vote through remote e-voting or e-voting during the AGM. The voting rights of the members shall be in proportion to their share in the paid-up equity share capital of the Company as on the cut-off date i.e. Friday, September 22, 2023. A person who is not Member as on the cut-off date should treat this Notice for information purposes only

Any person who acquires Shares and becomes Member of the Company after the dispatch of the AGN Notice and holds shares as on the cut-off date may use the existing User ID and password if they are already registered with NSDL for e-voting or follow the detailed procedure mentioned in AGM Notice o may obtain the User ID and password by sending request at <a href="mailto:evoting@nsdl.co.in">evoting@nsdl.co.in</a> or call at toll free no. 022- 2499 7000 and 022- 4886 7000.

The manner of casting votes through remote e-voting or through e-voting during the AGM for member holding shares in dematerialised mode, physical mode, and for members who have not registered the e-mail address, is provided in the Notice of AGM. The members who have not registered their e-mail addresses are requested to register the same in respect of shares held in dematerialized form with the respective Depository Participant and in respec

of shares held in physical form by sending an e-mail request to Company's RTA along with signed scanned copy of the request letter providing email address, mobile number, self-attested copy of PAN Card and copy of share certificate, or by following the process provided in the Notice of AGM Members are provided with a facility to attend the AGM through electronic platform provided by NSDL

Members are requested to visit <a href="https://www.evoting.nsdl.com">https://www.evoting.nsdl.com</a> and access the shareholders'/members login by using the remote e-voting credentials provided to them. In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of <a href="https://www.evoting.nsdl.com">www.evoting.nsdl.com</a> or

call on toll free no.: 022- 2499 7000 and 022- 4886 7000 or send a request to Mr. Anubhav Saxena a evoting@nsdl.co.in

Members may note that as per SEBI Circular No. SEBI/HO/MIRSD/MIRSD-PoD-1/P/CIR/2023/37 dated March 16, 2023, it is mandatory for all holders of physical securities in listed entities to update PAN, Address, Email ID, Bank account details (KYC details) and Nomination details of shareholders who have not updated the same with the Begistrar and Share Transfer Agent (BTA). Henceforth, the Company's RTA i.e. Bigshare Services Pvt. Ltd. will attend to all service requests of the shareholder with respect to transmission, dividend, etc., only after updating the above details in the records. If any of the KYC details are not undated in the folio on or before September 30, 2023, such folios shall be frozen by the RTA with effect from October 1, 2023, as per the above SEBI circula

ACS -22527

Place: Dharangadhra Date: September 06, 2023

Dilip Darj Sr. General Manager (Legal) & Company Secretary

# SCOOBEE DAY GARMENTS (INDIA) LIMITED Formerly known as Victory Paper and Boards (India) Limited

CIN: L27100KL1994PLC008083

Regd. Office:666/12, Anna Aluminium Building, Kizhakkambalam, Aluva, Ernakulam, Kerala - 683562 Web: www.scoobeedaygarments.com E-mail: info@scoobeedaygarments.com | Tel. No. 0484 2680701

## NOTICE OF 29th ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING INFORMATION

1. Notice is hereby given that the Twenty NinethAnnual General Meeting of the Company ("29th AGM") will be convened on Thursday, September 28, 2023 at 11:00 A.M. IST, through Video Conferencing (VC) or Other Audio Visual Means (OAVM) in compliance with all the applicable provisions of Companies Act, 2013 and the Rules issued thereunder and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 readwith Ministry of Corporate Affairs General Circular Nos. 02/2022, 21/2021 and 5th May 2020 respectively and SEBI circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated 13th May 2020 respectively and SEBI circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated 13th May 2022 along with other applicable circulars issued by the MCA and SEBI, to transact the business that will be set forth in the Notice of AGM. 2. The Notice of the 29th AGM and the Annual Report including the Financial Statements for the year ended 31stMarch, 2023 has been sent only by e-mail to all those Meml

For Nesco Limited

- whose email addresses are registered with the Company/Registrar and Transfer Agents (RTA) or with their respective Depository Participants, in accordance with aforesaid MCA Circular(s) and SEBI Circular dated May 13, 2022. 3. Members holding shares either in physical form or in dematerialized form, as on the cutoff date of 21st. September, 2023 may cast their votes electronically on the Ordinary and
- Special Business, as set out in the Notice of the 29th AGM through electronic voting (remote e-voting) facility of Central Depository Services (India) Limited (CDSL). All the model of the 29th AGM through electronic voting (remote e-voting) facility of Central Depository Services (India) Limited (CDSL).
- a) All businesses/resolutions set forth in the Notice of the 29th AGM may be transacted through voting by electronic means;
- b) The remote e-voting period shall commence on Monday, 25thSeptember, 2023 at 9.00 a.m.
- c) The remote e-voting period shall end on Wednesday, 27th September, 2023 at 5.00 p.m.; d) The cutoff date, for determining the eligibility to vote through remote e-voting or through e-voting system for the 29th AGM is 21stSeptember, 2023;
- e) Persons who have acquired shares and become members of the Company after the dispatch of the notice and hold shares as on the cut-off date of 21st September, 2023, may obtain the login ID and password by sending request at helpdesk.evoting@cdslindia.com or the Registrar And Transfer Agent M/s. Cameo Corporate Services Limited at the e-mail id investor@cameoindia.com;
- f) Members may note that a)remote e-voting module shall not be allowed beyond 05.00 p.m. on 27th September, 2023 and the same may be disabled by CDSL and once the vote on a resolution is cast by the Member, the Member shall not be allowed to change it subsequently; b) The Members who have cast their vote by remote e-voting prior to the 29thAGM through VC/OAVM Facility but shall not be entitled to cast their votes again through the e-voting system during the 29thAGM; c) the Members participating in the 29thAGM and who had not cast their vote by remote e-voting, system during the 29thAGM and who had not cast their vote by remote e-voting votes through E-Voting system during the 29thAGM; and d) a person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled
- to avail the facility of remote e-voting and e-voting during the 29thAGM; g) The Notice of the 29thAGM and the Annual Report are available on the website of the Company at www.scoobeedaygarments.com and on the website of BSE Limited at
- www.bseindia.com. The Notice of the 29thAGM is also available on the website of CDSL at https://www.evotingindia.com h) CS. Nikhil George Pinto, Partner, M/s. Caesar Pinto John & Associates LLP, Company Secretaries, Kochi, has been appointed as the Scrutinizer to scrutinize the remote E-voting
- process and casting vote through the E-voting system during the meeting in a fair and transparent manner Kindly note that Individual Members holding securities in Demat mode are allowed to vote through their demat account maintained with their Depositories and Depository Participants. Members are advised to update their mobile number and email id in their Demat accounts in order to access the E-voting facility. The information about logi credentials to be used and the steps to be followed for E-voting and joining virtual meetings are explained in the Notice of the 29thAGM. All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, Sr. Manager, (CDSL) Central Depository Services (India) Limited, A Wing, 25. Floor, Marathon Futures Malarial Mill Compounds, N M Joshi Marg, Lower Pare! (East), Mumbai - 400013 or send an email to helpdesk.evoting@cdslindia.com or call on 022-23058542/43.

Place: Kochi Date: 7th September, 2023

For Scoobee Day Garments (India) Limited

ID DHATRE

**DHATRE UDYOG LIMITED** 

(Formerly known as Narayani Steels Limited) CIN: L24319WB1996PLC082021 Read. Office: ERGO Tower.Plot No. - A1 -4. Block - EP & GP Unit No. - 1406, 14th Floor. Sector - V Bidhan Nagar CK Market Saltlake North 24 Parganas WB 700091 IN Corporate Office: Sy No 202 30 34 and 38 Part Modavalasa Village, Denkada Mandal Denkada Vizianagaram AP 535006 IN

Website: www.dhatre.com, Email id: info@dhatre.com Tel: 033 48040592 NOTICE OF (28TH) ANNUAL GENERAL MEETING OF THE COMPANY TO BE HELD

THROUGH VIDEO CONFERENCING (VC) / OTHER AUDIO-VISUAL MEANS (OAVM) NOTICE is hereby given that 28th Annual General Meeting ("AGM") of the members of the Company will be held on Friday, 29th September, 2023 at 1.00 p.m. (IST) through Video Conferencing ("VC")/Other Audio Visual Means ("OAVM") without physical presence of the nembers at a common venue, in compliance with the applicable provisions of the Companies Act 2013 and the Rules made thereunder ("the Act"), Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations") read with General Circular No. 14/2020 dated 8th April, 2020, General Circular No. 17/2020 dated 18th April, 2020, General Circular No. 20/2020 dated 5th May, 2020 and General Circular No. 10/2022 dated 28th December, 2022 issued by the Ministry of Corporate Affairs ("MCA") and SERI Circula lated 5th January, 2023, (Collectively referred to as "Circulars") to transact the business as se out in the Notice of AGM of the Company. Members will be able to attend and participate in the AGM by VC/OAVM only. Members attending the AGM through VC/OAVM will be counted for the purpose of reckoning the guorum under Section 103 of the Act.

In compliance with the aforesaid Circulars the Company has sent Notice of AGM and Annua Report for FY 2022-23 by electronic mode only, on Wednesday, 6<sup>th</sup> September, 2023, to all the nembers whose email addresses are registered with the Depository Participants up to Friday, 01

The Notice of the and Annual Report for FY 2022-23 can be downloaded from the Company' ebsite at www.dhatre.com

and website of the stock exchange, i.e., BSE Limited at www.bseindia.com.

REMOTE E-VOTING AND E-VOTING AT THE AGM

Pursuant to Section 108 of the Act read with Rule 20 of the Companies (Management 8 Administration) Rules, 2014, Regulation 44 of the Listing Regulations and Secretarial Standard on General Meetings, the Company has engaged services of Central Depository Services (India .imited ("CDSL") for providing remote e-voting facility prior to AGM ("remote e-voting")

Cut-off date for e-votingFriday,	22nd September, 2023
Commencement of Remote e-voting	9.00 a.m.(IST) on Monday, 25th September, 2023
Conclusion of Remote e-voting	5.00 p.m. (IST) on Thursday, 28th September, 2023

Members who will be present at the AGM through VC/OAVM and who have not cast their vote by emote e-voting, will be eligible to exercise their right to vote during the AGM. Members who have cast their vote by Remote e-voting prior to the AGM may also attend and participate in the AGM but shall not be entitled to cast their vote again.

Accordingly, members may cast their votes through remote e-voting and e-voting at the AGM by following the instructions mentioned in the Notice. Once the vote on a Resolution is cast by the

Member, he/she shall not be allowed to change it subsequently. The Company has appointed Ms. Ankita Dey (Membership No.A62192) Practising Company ecretary to act as a Scrutinizer for monitoring remote e-voting process and e-voting at the AGM in fair and transparent manner. The results of e-voting shall be declared within two working days from conclusion of the AGM. The results declared along with the Scrutinizer's Report shall be communicated to the Stock Exchange and will be placed on the website of the Company at

Members will be able to attend the AGM through VC/OAVM facility by using CSDL's Remote voting login credentials and by following the instructions mentioned in the Notice.

Any person, who acquires shares of the Company and becomes a Member of the Company afte dispatch of the Notice and is holding shares as of the cut-off date i.e., Friday, 22<sup>nd</sup> September 2023 may obtain the login ID and password by sending a request a helpdesk.evoting@cdslindia.com. However, if he/she is already registered with CSDL for remote -voting then he/she can use his/her existing User ID and password for casting the vote.

Members who need assistance before or during the AGM, can contact CDSL helpdesk by sending a request at mail to: <a href="mailto:helpdesk.evoting@cdslindia.com">helpdesk.evoting@cdslindia.com</a>.or call at toll free no. 1800 2255 33. Members are requested to carefully read all the Notes set out in the Notice of the AGM and in particular, instructions for joining the AGM, manner of casting vote through Remote e-voting o rough e-voting during the AGM.

For, Dhatre Udyog Limite (Formerly known as Narayani Steels Limited Date: 6th September, 2023 Company Secretary & Compliance office

### **VISA Steel Limited**

Registered Office: 11 Ekamra Kanan, Nayapalli, Bhubaneswar 751 015, Odisha orporate Office: "VISA House", 8/10 Alipore Road, Kolkata – 700027, West Benga Phone: (+91-674) 255 2479, Fax: (+91-674) 255 4661, Website: www.visasteel.com Email ID for registering Investor Grievances: cs@visasteel.com NOTICE OF THE 27th ANNUAL GENERAL MEETING **BOOK CLOSURE AND REMOTE E-VOTING INFORMATION** 

OTICE is hereby given that the 27th Annual General Meeting ("AGM") of the members of VISA Stee imited ("Company") will be held on Friday, 29 September, 2023 at 1200 hours through Video Conferencing (VC) / Other Audio Visual Means ("OAVM") in compliance with Section 96 of the Companies Act, 2013 ('the Act') and other applicable provisions of the Act read with relevant Rules pereof and in accordance with the Circular No. 14/2020 dated 8 April 2020. Circular No. 17/2020 date Table of and in accordance with the Citorian No. 17/2020 dated Spirit 2229, Directain No. 17/2020 dated and 18 3 April 2020, Circular No. 20/2020 dated 5 May 2020, Circular No. 02/2021 dated January 13, 2021, Circular No. 02/2022 dated May 05, 2022 and Circular No. 10/2022 dated December 28, 2022 issued by the Ministry of Corporate Affairs and SEBI Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022 and SEBI/HO/CFD/Po-P/P/CIR/2023/4 dated January 5, 2023 ("Circulars") for which purpose Registered Office situated at 1 Ekamra Kanan, Nayapalli, Bhubaneswar, Odisha - 751015 shall be deemed as venue for the eeting. The AGM shall transact the business(es) as set forth in the Notice convening the 27th AGM. olice is further given that pursuant to the provisions of Section 91 of the Companies Act, 2013 read with Rules made thereunder and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (hereinafter referred to as SEBI Listing Regulations), Friday, 22 September, 2023 to Friday, 29 September, 2023 (both days inclusive). In terms of the Circulars, the notice of AGM along with the copy of Annual Report for the Financial Year 2022-23 have been sent in electronic mode to members whose email IDs are registered with the Company or with the Depository Participants on 6 September 2023 and to those shareholders whose name appeared in the Register of Members as on 25 August 2023. Pursuant to the provisions of Section 108 of the Act. Rule 20 of the Companies (Management and

Administration) Rules, 2014 as amended and Regulation 44 of the SEBI Listing Regulations and Secretarial Standards on General Meetings (SS-2) issued by the Institute of Company Secretaries of ndia (ICSI), and in terms of SEBI Circular No. SEBI/HO/CFD/CIR/P/2020/242 dated 9 December 2020, the Company is pleased to provide to its members facility to exercise their right to vote on resolution(s) proposed to be passed at the AGM, by electronic means ("E-voting"). The process and manner of E-voting have been mentioned in relevant notes to the Notice convening the AGM. Members who have cast their vote by e-voting prior to the meeting may attend the meeting but will no pe entitled to cast their vote again. The Company has availed the services of KFin Technologie: .imited (earlier known as KFin Technologies Pvt. Ltd.) (hereinafter referred to as "KFintech") to provide the remote E-voting facilities.

Members holding shares in Electronic (Demat) form are advised to inform the particulars of their bank wembers notking shares in Electronic (Demat) form are advised to inform the particulars of their bah account, change of postal address, mobile number and email IDs to their respective Depositor, Participants only. The Company or its RTA i.e. KFin Technologies Limited, cannot act on any reques eceived directly from the members holding shares in demat mode for changes in any bank mandate: received directly from the members folding shares in definat mode for charges in any bark mandates or other particulars. Pursuant to Section 72 of the Companies Act, 2013, members holding shares in physical form are advised to inform the particulars of their bank account, change of postal address and email IDs to our RTA i.e. KFin Technologies Limited (Unit: VISA Steel Limited), Plot 31-32, Selenium ower B. Gachibowli, Financial District, Nanakramguda, Hyderabad – 500 032

embers may note that the Notice of the AGM and Annual Report 2022-23 will also be available on the company's website www.visasteel.com and website of the Stock Exchanges i.e. BSE Limited and lational Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com.respectivel nd on the website of KFin Technologies Limited at URL: https://evoting.kfintech.com All the members are hereby informed that the Ordinary and Special Business, as set out in the notice

of 27th AGM will be transacted through voting by electronic means only.

The detailed instructions for remote e-voting during the AGM are given in the Notice of the AGM.

embers are requested to note the following: an India are requested to rice an enclowing.
3 The remote e-voting will commence on Tuesday, 26 September, 2023 at 0900 Hrs and end or Thursday, 28 September 2023 at 1700 Hrs (both days inclusive). The remote e-voting will no be allowed beyond the aforesaid date and time and the e-voting module shall be disabled upo

expiry of aforesaid period. The facility for e-voting will also be made available during the AGM for the members who attend the meeting and have not cast their votes by e-voting earlier. b) The voting rights of members shall be in proportion to their shares in the paid-up equity share capital of the Company as on the cut-off date (i.e) 22 September 2023. Any person who acquires shares of the Company and becomes a member of the Company after the sending of Annual Report and Notice of the AGM electronically and holding shares on the cut-off date (i.e) 22 September 2023, may obtain login ID and password by writing to the Registrar and Transfe Agent of the Company at its e-mail ID suresh.d@kfintech.com.

he Company has appointed CS Debendra Raut, Practicing Company Secretary, (Membership No 116626 / CP No. 5232) of M/s. D Raut & Associates, Company Secretaries as Scrutinizer to scrutinize the e-voting process in fair and transparent manner. The Scrutinizer shall after conclusion of voting at the AGM, first count the votes cast at the meeting and thereafter unblock the votes cast through eoting and shall make Consolidated Scrutinizer Report of the votes cast in favour or against, if any and submit the same to the Chairman or person authorised by him in writing, who shall countersign the same and declare the result of the voting therewith. The Results shall be declared within two (2) working days of the conclusion of the AGM of the Company and the resolutions will be deemed to be passed on the AGM date i.e. 29 September 2023 subject to receipt of the requisite number of votes in

Members who may require any technical assistance or support before or during the AGM are requested to contact KFin Technologies Limited at toll free number 1800-309-4001 or write a

By order of the Board of Director Date: 6 September 2023 Amisha Chaturved

# Apollo Micro Systems Limited

(CIN: L72200TG1997PLC026556) Registered office: Plot No. 128/A, Road No. 12, BEL Road, IDA Mallapur, Hyderabad - 500076, Telangana. Telephone: +91 40 27167000 - 99; Fax: +91 40 2715 0820;

NOTICE TO SHAREHOLDERS REGARDING THE 26TH ANNUA GENERAL MEETING, E- VOTING INFORMATION AND RECORD DATE Notice is hereby given that the TWENTY SIXTH (26th) Annual General Meeting ("AGM") of the Members of Apollo Micro Systems Limited ("the

Company") will be held on FRIDAY the 29TH SEPTEMBER 2023 at 03:00 P.M. (IST) through Video Conferencing ("VC") / Other Audio Visual Means "OAVM") to transact the business as set out in the notice of 26th AGM. Pursuant to General Circular No. 14/2020 dated April 8, 2020, Genera Circular No. 17/2020 dated April 13, 2020, General Circular No. 20/2020 dated May 5, 2020, General Circular No. 02/2021 dated January 13 2021, General Circular No. 21/2021 dated December 14, 2021, Genera Circular No. 02/2022 dated 5 May 2022, General Circular No. 10/2022 and General Circular No. 11/2022 both dated 28 December 2022 (collectively referred to as 'MCA Circulars'), and SEBI vide its Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12 May 2020, EBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated 15 January 2021 SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated 13 May 2022 and

SEBI/HO/DDHS/DDHSRACPOD1/P/CIR/2023/001 dated 5 January 2023 and all other relevant circulars issued by the Ministry of Corporate Affairs the

Company is convening the 26th Annual General Meeting ("AGM"

'Meeting") through Video Conferencing ("VC") or Other Audio Visual Means

"OAVM"), without physical presence of the members at a common venue

2013 ("the Act") and the Securities and Exchange Board of India (Listing

accordance with the MCA Circulars, provisions of the Companies Act

Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations"), the AGM of the Company is being held through VC / OAVM. The deemed venue for the AGM shall be the Registered Office of the Company situated at Plot No 128/A, Road No. 12, Bel Road, IDA Mallapur

Uppal Mandal, Hyderabad - 500076. In compliance with the MCA Circulars and SEBI Listing Regulations, Notice of the AGM along with the Annual Report 2022-23 is being sent only through electronic mode to those Members whose e-mail address is registered with the Company / Depository Participants. Members may note that the Notice and Annual Report 2022-23 will also be available on the Company's website at the below given links for view or download, websites of the Stock Exchanges, that is, BSE Limited and National Stock Exchange of India .imited at www.bseindia.com and www.nseindia.com respectively, CDSI e. www.evotingindia.com and on the website of Company's Registrar and Transfer Agent, Bigshare Services Private Limited ("Bigshare") at www.bigshareonline.com.

The 26th AGM Notice and Annual Report for the FY 2022-2023 are vailable at the below given links for view or download:

aramasis arams some in green innie ier rien er ae innie ae.					
Sr. NO.	Document	Link to Click			
1.	26th AGM Notice	https://apollo-micro.com/wp-content			
		/uploads/2023/09/Notice-of-AGM-			
		2023.pdf			
_	Annual Report	https://apollo-micro.com/wp-content/			
2.	2022-23	uploads/2023/09/Annual-Report-			
		%E2%80%93-FY-2022-23.pdf			

The instructions for joining the AGM are provided in the Notice of AGM Members attending the AGM through VC / OAVM shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Act

To support 'Green Initiative' for receiving all communication (including Annual Report) from the Company electronically:

a) Members holding shares in physical mode and who have not registered ipdated their e-mail address with the Company are requested to register update the same by writing to the Company with details of folio number and attaching a self-attested copy of PAN card at **bsshyd@bigshareonline.com**  Members holding shares in dematerialized mode are requested to registe update their e-mail address with the relevant Depository Participant

n compliance with the provisions of Section 108 of the Act, Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, Secretaria Standard on General Meetings and Regulation 44 of the SEBI Regulations the facility for remote e-voting in respect of the business to be transacted at the AGM is being provided by the Company through CDSL. Necessary arrangements have been made by the Company with CDSL to facilitate emote e-voting.

The remote e-voting will be available during the following period:

Commencement of remote e-voting	From Monday, 25th September, 2023 (09:00 A.M. IST)	
End of remote e-voting	Till Thursday 28th September, 2023 (05:00 P.M. IST)	
The remote e-voting module shall be disabled by CDSL for voting after 28th		

September 2023, 05:00 P.M. (IST). Members who have cast their vote by remote e-voting prior to the AGM may attend / participate in the AGM through VC / OAVM but shall not be entitled to

cast their vote again E-votina durina the AGM:

Members, who are present at the AGM through VC / OAVM and have not casted their vote on the resolutions through remote e-voting and are otherwise not barred from doing so shall be eligible to vote through e-voting

Members whose names are recorded in the Register of Members of the Company or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the cut-off date i.e., Friday, 22nd September, 2023 will be entitled to cast their votes by remote e-voting or e-voting during the AGM. The voting right of members shall be in proportion to their shares of the paid up equity share capital of the company as on cut-off date. Once the vote on a resolution is cast by the shareholder, the shareholder would not be allowed to change it subsequently. A person who is not a member on the cut-off date should accordingly treat the AGM Notice as for information purposes only.

The detailed procedure for remote e-Voting, e-voting during the AGM and joining the AGM is provided in the Notice of the AGM.

Registration as a speaker during the AGM:

Members who would like to express their views or ask questions during the AGM may register themselves as a speaker by sending their request from heir registered email address mentioning their name, DP ID and Client D/folio number, PAN, mobile number along with their queries at cs@apollomicro.com till Saturday, 16th September, 2023 by 11:59 P.M. (IST). Only those members who have registered themselves as a Speaker will be allowed to express their views/ask questions during the AGM.

The Members who do not wish to speak during the AGM but have queries may send their queries in advance mentioning their name, demat accoun number/folio number. email id. mobile number at cs@apollo-micro.com til Saturday, 16th September, 2023 by 11:59 P.M. (IST). These queries will be replied by the company suitably by email.

All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, Sr. Manager, (CDSL, ) Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mi Compounds, NM Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to **helpdesk.evoting@cdslindia.com** or call toll free no. 1800 22 55 33.

NOTE: Pursuant to Finance Act 2020, dividend income will be taxable in the nands of shareholders w.e.f. April 1, 2020 and the Company is required to deduct tax at source from dividend paid to shareholders at the prescribed ates. For the prescribed rates for various categories, the shareholders are requested to refer to the Finance Act, 2020 and amendments thereof. The shareholders are requested to update their PAN with the Company / RTA (ir case of shares held in physical mode) and depositories (in case of shares held in demat mode).

A Resident individual shareholder with PAN and who is not liable to pay ncome tax can submit a yearly declaration in Form No. 15G/15H, to avail the benefit of non-deduction of tax at source by email to cs@apollo-micro.com by 11:59 p.m. IST on Friday, 22nd September, 2023. Shareholders are requested to note that in case their PAN is not registered, the tax will be deducted at a higher rate of 20%. Non-resident shareholders can avai peneficial rates under tax treaty between India and their country of residence subject to providing necessary documents i.e. No Permanent Establishmer and Beneficial Ownership Declaration, Tax Residency Certificate, Form 10F any other document which may be required to avail the tax treaty benefits by sending an email to cs@apollo-micro.com. The aforesaid declarations and documents need to be submitted by the shareholders on or before 11:59

p.m. IST on Friday, 22nd September, 2023 Wishing for you and your family's safety; Stay Safe and Stay Healthy.

For Apollo Micro Systems Limited

Karunakar Reddy Baddam Place: Hyderabad **Managing Director** 























એક્સિસ બેંક લીમીટેડ (CIN: L65110GJ1993PLC020769) કોર્પોરેટ ઓફીસ, એક્સીસ હાઉસ, સ્ટ્રક્ચર્ડ એસેટ્સ ગ્રુપ, સી-ર, વાડિયા ઇન્ટરનેશનલ સેન્ટર, પાંડુરંગ બુધકર માર્ગ, વર્લી, મુંબઇ-૪૦૦૦૨૫

સ્થાવર મિલકતોના વેચાણ માટે વેચાણ નોટીસ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ના સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એનફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮(૧) ની જોગવાઇઓ સાથે વાંચન હેઠળ સ્થાવર મિલકતોના વેચાણ માટે ઈ-હરાજી વેચાણ નોટીસ. આથી ખાસ કરીને દેવાદાર શ**રણમ એલ્યુમિનિયમ એક્સ્ટ્રશન પ્રાઇવેટ લીમીટેડ (અગાઉ આરકી એક્સ્ટ્રશન પ્રાઇવેટ લીમીટેડ તરીકે જાણીતી)** અને જામીનદાર(રો)/ગીરવેદાર(રો)/ માલિક(કો) એટલે કે શ્રી પિયુષ પુનમચંદ શાહ, શ્રી અશોક કુમાર પુરસોત્તમદાસ પંચાલ, શ્રી હરિશ દુર્લભદાસ કાગરાણા અને **શ્રીમતી પ્રાર્થના હરિશભાઇ કાગરાણા** અને જાહેર જનતાને આથી નોટીસ આપવામાં આવે છે કે નીચે દર્શાવેલ સ્થાવર મિલકત એક્સીસ બેંક લીમીટેડ એટલે કે સિક્ચોર્ડ લેણદારને ગીરો/ચાર્જડ કરાચેલ છે, જેનો ભૌતિક કબજો એક્સીસ બેંક લીમીટેડ એટલે કે સિક્ચોર્ડ લેણદારના અધિકૃત અધિકારીએ લઇ લીધો છે, "જેનું જ્યાં છે", "જે છે" અને "જેમ છે" ના ધોરણે અને કોઇ આશ્રય વિના **૦૫ ઓક્ટોબર, ૨૦૨૩** ના રોજ સદરહું દેવાદાર /જામીનદાર(રો)/ગીરવેદાર(રો)/માલિક(કો) પાસેથી એક્સીસ બેંક એટલે કે સિક્ચોર્ડ લેણદા૩૨ની બાકી ૨કમ રૂા.૭,૪૭,૫૬,૧૬૮/– (રૂપિયા સાત કરોક સુકતાલીસ લાખ છપ્પન હજાર એકસો અડસઠ પુરા) 30.0**૬.૨૦૧૯** મુજબ વત્તા ૦૧.૦૭.૨૦૧૯ થી કરારના દરે રાડત વ્યાજની વસુલાત માટે વેચવામાં આવશે. રીઝર્વ કિંમત નીચે મુજબ છે:

મિલકતની વિગત	રિઝર્વ કિંમત	અર્નેસ્ટ મની ડિપોઝીટ (ઇએમડી)	ઓક્શન આઇડી	
રેવન્યુ સર્વે નં. ૯૦/૩, બ્લોક નં. દૃદ્દ, એનએ જમીન ક્ષેત્રફળ ૨૦૨૩ ચો.મી. અને તેના પરનું બાંધકામ (ક્ષેત્રફળ ૯૨૭ ચો.મી.) મોર્જ આલમગીર, જિલો વડોદરા ખાતેની ઇન્ડસ્ટ્રીચલ મિલકત.		રૂા. ૧૩,૪૦,૦૦૦/– (રૂપિયા તેર લાખ ચાલીસ હજાર પુરા)	<b>૨</b> ૭૯૧૪૦	
પ્લાન્ટ અને મશીનરી	રૂા. ૨૫,૦૦,૦૦૦/– (રૂપિયા પસ્ચીસ લાખ પુરા)	રૂા. ૨,૫૦,૦૦૦/– (રૂપિયા બે લાખ પસ્ચાસ હજાર પુરા)	૨૭૯૧૪૧	
રેવન્યુ સર્વે નં. ૯૭૧, ટાઉન પ્લાનિંગ નં. ૪, ગ્રા. ગ્રા. ૧,૧૪,૦૦૦/– કાઇનલ પ્લોટ નં. ૫૨૦ પૈકી, શોપ નં. ૦૫, ગ્રાઉન્ડ ક્લોર, ગોકુલ ઉપવન તરીકે જાણીતી સ્કીમમાં, (ગ્રિપેચા ક્ષેત્રકૃળ ૧૮૦.૦૦ ચો.ક્ટુર, કોમન જમીન ક્ષેત્રકૃળ હન્દ.૬૨ ચો.ક્ટુ. રોડ બાપોડ, મોજેબાપોડ, વડોદરા સાલીસ પુરા) પુરા) સિક્ચોર્ડ એસેટ પરત મેળવવા માટે ઉપલબ્દ સમયમર્થાદાના સબંદામાં એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ (૮) ને				

ભાગવાડા અના વધા માટે વધાવાડા સાથે કરવાડા કરવાડા કરવાડા કરવા પડ ગાં પડા કરવા (દ) ગાં જોગલાઇઓ પ્રત્યે દેવાદાર/જમીનદાર(રો)/ગીરદાર(રો) નું દયાન દોરવામાં આવે છે. વેચાણની વિગતવાર શરતો નિચમો માટે https://www.axisbank.com/auction-notices અને/અથવા https://axisbank.auctiontiger.net પર આપેલ લિંક જોવા વિનંતી છે.

તારીખ : ૦૭–૦૯–૨૦૨૩ સહી/– અધિકૃત અધિકારી એક્સિસ બેંક લીમીટેડ સ્થળ : વડોદરા

### કેલિસ્ટા ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ

(અગાઉ સીએશપીએલ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ તરીકે જાણીતી) રજીસ્ટર્ડ ઓફીસ : ૪૪ એમ્પાચર સ્કવેર, વિદ્યાભારતી કોલેજ સામે, બાળેન, તાલુકો–બારડોલી, બારડોલી, સુરત (ગુજ.) ૩૯૪૬૦૨ CIN : L65921GJ1989PLC098109 ઇમેઇલ : chpli 33મી વાર્ષિક જનરલ મીટીંગ, રિમોટ ઇ-વોટીંગ માહિતી અને બુક ક્લોઝરની નોટીસ

 આથી નોટીસ આપવામાં આવે છે કે કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા સમય સમય પર આપવામાં આવેલા સામાન્ય પરિપત્રો, ક્રમવાર પરિપત્રો (એમસીએ પરિપત્રો) સાથે વંચાતી કંપનીઝ એક્ટ, ૨૦૧૩ (એક્ટ) ની લાગૃ પડતી જોગવાઈઓ અને તેની હેઠળ બનાવેલા નિચમોના અનુપાલનમાં, એજીએમની નોટીસમાં નિર્ધારીત મુજબના વ્યવસાયના વ્યવહારો કરવા માટે કેલિસ્ટા ઈન્ડ્સ્ટ્રીઝ લિમિટેડ (અગાઉ સીએસપીએલ ઈન્ડ્સ્ટ્રીઝ . લિમિટેડ તરીકે જાણીતી )(ધી કંપની) ના સભ્યોની વાર્ષિક જનરલ મીટીંગ વીડિયો–કોન્ફરન્સીંગ/અન્ય દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો (વીસી/ઓએવીએમ) મારફતે શુક્રવાર, ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ બપોરે ૦૧.૦૦ કલાકે ભારતીય સમયે યોજાશે.

ર.તમામ સભ્યો, જેમના ઇમેઇલ આઇડીઝ કંપની/આરટીએ/ડિપોઝીટરી સહભાગી(ઓ)પાસે, કટ–ઓફ તારીખ એટલે કે ૦૧લી સપ્ટેમ્બર, ૨૦૨૩ મુજબ નોંધાચેલા છે તેમને એજીએમની નોટીસ અને ૩૧ માર્ચ, ૨૦૨૩ ના પૂર થતા નાણાકીચ વર્ષ માટેના વાર્ષિક રિપોર્ટની ઇલેક્ટ્રોનિક કોપી મોકલી દેવામાં આવી છે. કૃપા કરી નોંધ લેશો કે સભ્યોને એજીએમની નોટીસ અને વાર્ષિક રિપોર્ટની ભૌતિક નકલ મોકલવાની આવશ્યક્તા એમસીએ પરિપત્રોથી સમાપ્ત કરવામાં આવી છે. નોટીસ અને વાર્ષિક રિપોર્ટ કંપનીની વેબસાઈટ www.callistaindustries.com ઉપર પણ ઉપલબ્ધ રહેશે અને ત્યાંથી ડાઉનલોડ પણ કરી શકાશે. 3.સભ્યોદ્વારામતો આપવાની સુવિધા(ઇ–વોટીંગ)સીડીએસએલ(સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસીઝલિમિટેડ)દ્વારા પૂરી પાડવામાં આવશે તેની વિગતવાર પ્રક્રિયા એજીએમની નોટીસમાં આપવામાં આવી છે. રિમોટ ઇ–વોટીંગ .. સમયગાળો મંગળવાર, રદ્દમી સપ્ટેમ્બર, ૨૦૨૩ થી ગુરૂવાર, ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધી રહેશે. આ સમયગાળ દરમિયાન કંપનીના ભૌતિક રૂપમાં અથવા ડિમટીરીયલાઈ ઝડ રૂપમાં રુમી સપ્ટેમ્બર, ૨૦૨૩ ની કટ–ઓફ તારીખ મુજબ શેરો ધરાવતા સભ્યો, રિમોટ ઇ–વોટીંગ દ્વારા અથવા એજીએમના સમયે ઇ–વોટીંગ દ્વારા તેમના મત આપી શકશે. રૂબરૂમાં ભાગ લેતા સભ્યોની એક્ટની ક્લમ ૧૦૩ હેઠળ કોરમના હેતુ માટે ગણતરી કરવામાં આવશે. ૪.સભ્યો, જેઓ ફિઝીકલ/ઇલેક્ટ્રોનિક રૂપમાં શેરો ધરાવતા હોય અને તેમના ઇ–મેઇલ એડ્રેસીઝ કંપની/તેમના સંબંધિત ડિપોઝીટરી સહભાગીઓ પાસે નોંધાચેલા ન હોય. તેમને એજાએમની નોટીસની સાથે ૨૦૨૨–૨૩ ને વાર્ષિક રિપોર્ટ મેળવવા માટે પાન કાર્ડ ની સ્વંચ-પ્રમાણિત સ્કેન્ડ કોપી અને સભ્ય તરીકે કંપની પાસે નોંધાચેલા સરનામાના પૂરાવાના આધારમાં આધાર કાર્ડ,ડ્રાઈવીંગ લાયસન્સ,ચૂંટણી કાર્ડ,પાસપોર્ટ,ચુટિલિટી બિલ અથવા કોઇપણ સરકારી દસ્તાવેજ જેવા દસ્તાવેજો માંથી કોઇપણ એક ની નકલ સહિત સભ્ય(યો) દ્વારા યોગ્ય રીતે સહી કરેલ તેમનું નામ, સંપૂર્ણ સરનામું, ફોલિયો નંબર, કંપનીના તેમણે ધરાવેલા શેરોની સંખ્યા જણાવતા પત્રની સ્કેન્ડ કોપી <u>chplindustriesItd@gmail.com</u> ને ઇમેઈલ દ્વારા મોકલીને વહેલી તકે તેમના ઇ–મેઈલ રજીસ્ટર કરાવવાની વિનંતી કરવામાં આવે છે. ડિમેટ રૂપમાં શેરો ધરાવતા સભ્યો તેમના ડિપોઝીટરી સહભાગીઓ પારે તેમના ઇમેઈલ એડ્રેસ અપડેટ કરાવી શકે છે. એજીએમની નોટીસમાં પદ્ધતિ જેમાં શેરહોલ્ડર્સ રિમોટ ઇ–વોટીંગ મારકતે અથવા એજાએમના સમયે ઇ-વોટીંગ દ્વારા તેમના મત આપી શકે સમાવિષ્ટ કરવામાં આવી છે u. સભ્યોનું રજીસ્ટર અને કંપનીની શેર ટ્રાન્સફર બુક્સ શનિવાર, ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૩ થી શુક્રવાર, ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૨૩ (બંને દિવસો સહિત) સુધી બંધ રહેશે.

દ્ર. સભ્યોને મોકલવામાં આવેલ એજીએમની નોટીસ અને નાણાકીય વર્ષ ૨૦૨૨–૨૩ માટેનો વાર્ષિક રિપોર્ટલાગ્ થતી જોગવાઈઓના યોગ્ય ક્રમ અનુસાર આપવામાં આવેલ છે. કેલીસ્ટા ઈન્ડસ્ટીઝ લીમીટેડ વર્તી (અગાઉ સીએચપીએલ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ તરીકે જાણીતી) સહી/-આશિષ ગાંદી

સંપર્ણ સમયનાં ડાયરેકટર તારીખ : ૦૫.૦૯.૨૦૨૩

વાસ્તુ હાઉસિંગ ફાયનાન્સ કોર્પોરેશન લીમીટેડ યુનિટ ર૦૩ અને ૨૦૪, બીજો પાધા, "એ" વિંગ, નવભારત એસ્ટેટ, ઝકારિયા બુંદેર રોડ, સેવરી (પાધા, મું મુંબઇ-૪૦૦૦૧૫. મહારાષ્ટ્ર. CIN No. U65922MH2005PLC272501

### કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે)

ra જણાવવાનું કે **વાસ્તુ હાઉસિંગ ફાયનાન્સ કોર્પોરેશન લીમીટેડ** ના નીચે સહી કરનાર અધિકૃત ખધિકારીએ સિક્ચોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાનિસ્ચલ એસેટ્સ અ<sup>ન</sup> એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ,૨૦૦૨ <u>હે</u>ઠળ અને સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ ના રૂલ ૯ સાથે વંચાતી કલમ ૧૩(૧૨) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાનો કૈપચોગ કરીને, તારીખ **૧૫-ડિસેમ્બર-૨૦૨૩** ના રોજ માંગણા નોટીસ જારી કરીને દેવાદાર/રો થ્રી/શ્રીમતી બાલક્રિષ્ન રવિન્દ્રનારાયણ તિવારી (અરજદાર), શ્રી/શ્રીમતી મમતા બાલક્રિષ્ના <mark>તિવારી (સહ–અરજદાર) ને લોન એકાઉન્ટ નંબર LP000000013452</mark> ની ૨કમ **રૂા**. **૧૧૩૦૬૩/– (રૂપિચા ચાર લાખ તેર હજાર ત્રૈસઠ પુરા) ૦૫–કિસેમ્બર–૨૦૨૩** મુજબની નોટીસમાં જ્યાવેલ રકમ<sup>ે</sup> જ્યાવેલ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ચુકવવા જ્યાવ્યું હતું. દેવાદારો રકમ ચુકવવામાં નિષ્ફળ રહ્યા હતા. પરિણામે દેવાદારો, જામીનદારો અને જાહેર જનતાને અહીં નોટીસ પાઠવવામાં આવે છે કે નીચે સહી કરનારે જણાવેલ નિયમોના નિયમ ૯ સાથે વંચાતી જ્યાવેલ કાયદાની કલમ ૧૩(૪) હેઠળ મળતી સત્તાનો ઉપયોગ કરીને નીચે જણાવેલ મિલકતો મૌત્તિક કબ**જો ૦૬–સપ્ટેમ્બર–૨૦૨૩** ના રોજ લઇ લીધો છે.

પરિણામે ખાસ કરીને દેવાદારો, જામીનદાર અને જાહેર જનતાને નીચે જણાવેલ મિલકત સાથે કોઇપણ જાતનો વ્યવહાર ન કરવા માટે સાવધ કરવામાં આવે છે અને મિલકત સાથેનો કોઇપણ વ્યવ<mark>હાર **વાસ્તુ હાઉસિંગ ફાયનાન્સ કોર્પોરેશન લીમીટેડ (સુરત શાખા)</mark> ની ૨કમ</mark>** રૂા. ૪૧૩૦૬૩/- (રૂપિયા ચાર **લાખ તેર હજાર ત્રેસઠ પુરા**) અને તેના પરના વ્યાજ, ખર્ચ વગેરેના

### સ્થાવર મિલકતોની વિગત

શોપ નં. એ–૬, સાંઇ એવન્યુ, પ્રિયંકા પાર્ક પાસે, કાડોદરા, પલસાણા, ગુજરાત–૩૯૪૩૨૭

ra જણાવવાનું કે **એસેટ રીકન્સ્ટ્રક્શન કંપની (ઇન્ડિયા) લીમીટેડ**ના અધિકૃત અધિકારીર તેક્ચોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીર્ટ ાન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ (૨૦૦૨ નો ૫૪) હેઠળ અને સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ન નિયમ ૩ સાથે વંચાતી કલમ ૧૩ (૧૨) હેઠળ પ્રાપ્ત સત્તાની રૂએ જણાવેલ કાયદાની કલમ ૧૩(૨) હેઠળ માંગણ ગોટીસ જારી કરીને નીચેના દેવાદારોને જણાવેલ નોટીસમાં જણાવ્યા અનુસાર તેમના સંબંધિત નામ સામે જ્યાવેલ ૨કમ લાગુ દરોએ તેના પરના વ્યાજ સહિત ચુકવણીની અને/અર્થવા વસુલાત સુધીની તારીખ સુધી

લાગુ, આકરિમક ખર્ચ, બોજા, ચાર્જ વગેરે સહિત જણાવેલ નોટીસોની મળ્યાની તારીખથી દે ૦ દિવસની અંદર

યુંકવા પવા નાટ પંચાવ્યું હતું.					
લોન એકાઉન્ટનું નંબર / સેલિંગ બેંક	દેવાદાર/સહ– દેવાદાર/જામીનદારનું નામ	માંગણા નોટીસ મુજબ કુલ બાકી / ૧૩(૨) નોટીસની તારીખ	કબજાનો પ્રકાર અને તારીખ		
BRDHL 16000315 & BRDHL 1600316 એલ એન્ડ ટી ફાયનાન્સ લીમીટેડ	સમિરભાઇ લક્ષ્મણરાવ ધ્રુવે અને શિતલ લક્ષ્મણરાવ ધ્રુવે	३१. ६४,०७,०६२.२२/- ०६-०६-२०१८	03-06-૨0૨3 ભૌતિક કબજો		

**સિક્ચોર્ડ મિલકતનું સરનામું** :ક્લેટ નં. એ-૫૦૨,પાંચમો માળ,(લોઅર અપ્પર), ફ્રિસ્ટલ વ્હાઇટ, નિલમબાર પાછળ, વાસણા-ભાચેલી રોડ, વડોદરા, ગુજરાત તેમજ તેના પરના રાઇટ, ટાઇટલ અને હિત. **ચતુઃસીમા** :પુર્વ : હાઉસ નં. એ/૫૦૧,પશ્ચિમ :કોમન રોડ,ઉત્તર : અંદરનો રોડ,દક્ષિણ

yત જણાવવાનું કે અહીં ઉપર જણાવેલ દેવાદારો બાકી લેણાંની રકમની ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી ખાસ કરીને ઉપર જણાવેલ દેવાદારો અને જાહેર જનતાને અહીં નોટીસ આપવામ આવે છે કે **આર્સિલ**ના અધિકૃત અધિકારીએ અહીં ઉપર જ્યાવેલ મિલકતોનો /સિક્ચોર્ડ મેલકતોનો **ભૌતિક કબજો** જણાવેલ નિયમોના નિયમ ૮ સાથે વંચાતી જણાવેલ એક્ટની કલમ્ ૧૩(૪) હેઠળ લઇ લીધો છે.

માસ કરીને અહીં ઉપર જણાવેલ દેવાદારો અને જાહેર જનતાને ઉપર જણાવેલ મિલકતો / સિક્યોર્ડ એસેટો સાથે સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને જણાવેલ મિલકતો/સિક્ચોર્ડ એસેટો સાથે કોઇપણ સોદો આર્સિલના ચાર્જ અને તેના પરના વ્યાજને આધિન રહેશે. સિક્ચોર્ડ મિલકતો પરત નેળવવા માટે ઉપલબ્ધ સમયના સંબંધમાં એક્ટની ક્લમ ૧૩ ની પેટા કલમ (૮) ની જોગવાઇએ પ્રત્યે દેવાદારોનું ધ્યાન દોરવામાં આવે છે.

સહી/- અધિકૃત અધિકારી એસેટ રિકન્ટ્રક્શન કંપની (ઇન્ડિયા) લીમીટેડ. રથળ : ગુજરાત તારીખ : ૦૭.૦૯.૨૦૨૩ એસેટ રિકન્ટ્રક્શન કંપની (ઇન્ડિયા) લીમીટેડ



CIN No.: U65999MH2002PLC134884. Website: www.arcil.co.in **૨જીસ્ટર્ડ ઓફીસ:** ધ રૂબી,૧૦મો માળ, ૨૯ સેનાપતી બાપટ માર્ગ. દાદ૨ (પશ્ચિમ). મુંળઇ-૪૦૦૦૨૮, ફોર્ન : +૯૧ ૨૨૬૬૫૮૧૩૦૦ શાખાનું સરનામું: ૬૧૦, સન રક્લેટ, હોટેલ રેગેન્ટા સેન્ટ્રલ, સી.જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૬, ગુજરાત.

## બજાજ ફાચનાન્સ લીમીટેડ

કોર્પોરેટ ઓફીસ : ગીજો માળ, પંચશીલ ટેક પાર્ક, વિમાન નગર, પુણે, મહારાષ્ટ્રા, ભારત-૪૧૧૦૧૪ શાખા ઓફીસ : બીજો માળ, બિઓ એટલાન્ટીક, ઓફીસ-૨૧૨-૨૧૩, બીજો માળ, અંબર સિનેમા સામે, પંડિત નેહરુ માર્ગ, જામનગર, ગુજરાત-૩૬૧૦૦૮ સિક્યોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્ક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ

ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩(૨) હેઠળ માંગણા નોટીસ મેસર્સ બજાજ કાયનાન્સ લીમીટેડના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ દેવાદાર(સે) / સહ–દેવાદાર(સે) જેઓ બજાજ કાયનાન્સ લીમીટેડ દ્વારા તેમને અપાચેલ મિલકત સામેની હોમ લોન(નો)/ લોન(નો) માટે તેમની જ્વાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ ગયા છે એટલે કે મુદ્દલ તેમજ . વ્યાજઅને તેના પર લદાચેલ અન્ય ચાર્જની ચુકવણીમાં કસુર કર્યો છે અને પરિણામે લોન(નો) નોન પરફોર્મિંગ એસેટ્સ તરીકે વર્ગીકૃત કરાચા હતા તદ્દઅનુસાર સિક્ચોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓર્ક્કાચનાન્સિયલ એસેટસ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ની કલમ ૧૩(૨) અને તે હેઠળના નિચમો હેઠળ તેમને તેમના છેલા જાણીતા સરનામાં પર નોટીસો જારી કરાઇ હતી. આમ છતાં તે બજવણી વગર રવાનગી વગર પરત ફરી હતી આથી આવા દેવાદાર(રો)/સહ-દેવાદાર(રો) ને આથી સમચે સમચે તેમને લીધેલ લોન સવલતો હેઠળ તેમના બાકી લેણાંની પતાવટ કરવા માટે આ પ્રકાશીત નોટીસના માર્ગે જાણ / માહિતગાર કરવામાં આવે છે.

	િલણાં વેલાવટ કરવા માટે આ પ્રકાશાલ ગાટારાંના મા		
દેવાદાર(રો)/સહ-દેવાદાર(રો)/જામીનદાર(રો) નું નામ અને સરનામું લોન એકાઉન્ટ નંબર		સિક્યોર્ડ એસેટ / ગીરો સ્થાવર મિલકતની વિગત / ટાંચમાં લીદોલ મિલકત	માંગણા નોટીસની તારીખ અને રકમ
	<b>૧. જ્યરાજ બંધાણી પેલેસ (એચયુએફ) (દેવાદાર)</b> <b>સરનામું</b> : ૫૮/૫૯, દિગ્વીજય પ્લોટ, જામનગર, ગજરાત-૩૬૧૦૦૫ . <b>અહીં પ્રા</b> ગ : પ્લોટ નં. ૦૨.	નીચેની બિન–ખેતીલાયક મિલકતના તમામ ભાગ અને હિસ્સા : પ્લોટનં.૨પૈકી ક્ષેત્રફળ ૧૦૧.૧૭૨ ચો.મી,મિલકત જુનો સિટી સર્વે નં. ૧/ઝ/૪ પૈકી અને નવો સિટી સર્વે નં.૧૯૪૩, શિટ નં.૧૮૦, વોર્ડ નં. ૧૦, ગુરુ દત્તાત્રૈય મંદિર પાસે, જામનગર ખાતેની બાંધકામ રેસિડેન્સીયલ મિલકત. પુર્વ : અંબા વિજય પ્રાઇવેટ લીમીટેડની	રૂા. ૧,૨૧,૩૪,૨૫૭/– (રૂપિયા એક કરોડ એકવીસ લાખ યોત્રીસ હજાર બસ્સો સત્તાવન
	35400H	મિલકત, પશ્ચિમ : રોડ, ઉત્તર : પ્લોટ નં. ૩, દક્ષિણ : પ્લોટ નં. ૨ પૈકી	પુરા)

**ર. વિનોદરાંદ્ર જગજિવન શાહ (સહ-દેવાદાર) સરનામું** : વિરલ બાગ પેલેસ રોડ, જામનગર, ગુજરાત–૩૬૧૦૦૮

**૩. કુસુમ વિનોદચંદ્ર શાહ (સહ-દેવાદાર) સરનામું** : પેલેસ રોડ વિરલ બાગ, જામનગર, ગુજરાત-૩૬૧૦૦૮ **૪. રાજેશભાઇ વી. શાહ (સહ-દેવાદાર) સરનામું** : ગુરુદત્તાત્રૈય મંદિર પાસે, જેલ રોડ, જયરાજ જેલ રોડ, જામનગર, ગુજરાત-૩૬૧૦૦૧

**૫. જ્યંતિ વિનોદચંદ્ર શાહ (સહ-દેવાદાર) સરનામું :** ગુરુ દત્તાશ્રેય મંદિર, જામનગર–૩૬૧૦૦૮

આપગલા નોટીસની વૈકલ્પીક બજવણી માટે લેવાઇ રહ્યાં છે. ઉપરોક્ત દેવાદારો અને/અથવા સહ-દેવાદારો, જામીનદારોને આ નોટીસના પ્રકાશનની આ પંગલા ભાટાસના પાકલ્પાક બગવાદા માટે લાઇ કહ્યાક. ઉપરાક્ત દેવાદારા અભુ અંધવાસ ૯-દવાદારા, જામાળદારાળ આ નાટાસના પ તારીખશ્રી ૬૦ દિવસની અંદર બાકી લેણાની વ્યાજસહીત ચુકવાણી કરવા સલાહ આપવામાં આવે છે, જેમાં નિષ્ફળ જતાં (બજાજ ફાયનાન્સ લીમીટેડને પ્રાપ્ત કોઇ અન્ય હેક પ્રત્યે પૂર્વગ્રહ વગર) સિક્ચોર્ડ એસેટ / ગીરો મિલકતોના કબજા માટે અન્ય પગલાં સિક્ચોરીટાઇગ્રેશન અને રીકન્શ્ટરક્શન ઓફ્ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩(૪) ની જોગવાઇઓ અનુસાર શરૂ કરવામો

ઉપર જણાવેલ વ્યક્તિઓને ઉપર જણાવેલ મિલકતો જેના પર બજાજ ફાચનાનન્સ લીમીટેડનો ચાર્જ છે તેને બીજાને નામે કરવા, ત્રાહીત વ્યક્તિન્ હિત ન સર્જવા પણ સલાહ આપવામાં આવે છે.

તારીખ : ૦૭.૦૯.૨૦૨૩, સ્થળ : ગુજરાત અદિકૃત અદિકારી, બજાજ ફાયનાન્સ લીમીટેડ

# ઇક્વિટાસ સ્મોલ ફાચનાન્સ બેંક લીમીટેડ (અગાઉ ઇક્વિટાસ ફાચનાન્સ લીમીટેડ તરીકે જાશીતી) કોર્પોરેટ ઓફીસ: નં. ૭૬૯, સ્પેન્સર પ્લાઝા, ચોથો માળ, ફેઝ- ૨, અજ્ઞા સલાઇ, ચેજ્ઞાઇ, ટીએન - ૬૦૦ ૦૦૨

કબજા નોટીસ (નિચમ ૮(૧) હેઠળ – સ્થાવર મિલકત માટે)

આથી મેસર્સ ઇક્વિટાસ રમોલ ફાયનાન્સ બેંક લીમીટેડના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ સિક્ચોરીટાઇગ્રેશન અને રીકનસ્ટ્રક્શન ઓ ફાયનાન્સિયલ એસેટ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨નો ૫૪) હેઠળ અને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો . ૨૦૦૨ ના (નિયમ ૩) સાથે વંચાતી કલમ ૧૩(૧૨) હેઠળ મળેલી સત્તાની રૂએ નીચે જણવેલ દેવાદારોને નોટીસમાં જણવેલ કુલ ૨૬મ જણવેલ નોટીસ મળ્યા તારીખથી ૬૦ દિવસની અંદર પરત ચુકવવા જણાવ્યું હતું. નીચે જણાવેલ દેવાદારો જણાવેલ સમયગાળા દરમિયાન રકમની પરત ચુકવણી કરવામાં નિષ્ફત ગયા હોવાથી નીચે જણાવેલ દેવાદારો અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮ સાદ વાંચી કલમ ૧૩ ની પેટા કલમ (૪) હેઠળ તેને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને અહીં નીચે જણાવેલ મિલકતનો કબજો લઇ લીધો છે. ખાસ કરીને દેવાદારો અ જાહેર જનતાને આથી નીચે જણાવેલ મિલકતો સાથે કોઇ સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને મિલકત સાથેનો કોઇપણ સોદો મેસર્સ ઇક્વિટાસ સ્મો ફાચનાન્સ બેંક લીમીટેડની બાકી રકમ અને તેના પરનું ચડત વ્યાજ અને અન્ય ચાર્જિસના ચાર્જને આદાન રહેશે. સિક્ચોર્ડ મિલકતો પરત મેળવવા માતે

ઉપલબ્ધ સમયના સંબંધમાં એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ (૮) ની જોગવાઇઓ પ્રત્યે દેવાદારોનું ધ્યાન દોરવામાં આવે છે.				
દેવાદાર(રો) / જામીનદાર(રો) નું નામ	સિક્યોર્ડ એસેટ (સ્થાવર મિલકત) ની વિગત	માંગણા નોટીસની તારીખ અને રકમ	કબજાની તારીખ	
લોન નં.: SEJAMNR0231176 શાખા : જામનગર દેવાદાર : ૧. શ્રી કાનાભાઇ નાથાભાઇ પરમાર ૨. શ્રીમતી કાળીબેન કાનાભાઇ પરમાર ૩. શ્રી સુનિલ કાનાભાઇ પરમાર	હાઉસ નં. ૬૧૮, ગામતલ, મોટી ખાવડી, તાલુકો અને જિહ્યો જામનગર, ક્ષેત્રફળ ૪૫૦ ચો. કુટ (૪૧.૮૨ ચો.મી.), તેમજ તેના પરના વર્તમાન અને ભાવી સુપર સ્ટ્રક્ચર ધરાવતી જમીન તેમજ બિલ્ડીંગના તમામ ભાગ અને હિસ્સા. ચતુ:સીમા: ઉત્તરઃ પ્લોટનં. ૧૦૨/૩, દક્ષિણઃ પ્લોટનં. ૧૦૨/૧, પુર્વ: રોડ, પશ્ચિમઃ પ્લોટનં. ૧૦૨/૭, ક્ષેત્રફળ ૪૫૦૦ ચો. કુટ, મિલકતના લોન એગ્રોમેન્ટ કમ ગીરો હેઠળની સબ રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ જામનગર, અને રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ જામનગર ખાતેની સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા.	શ. ૨૧૦ <b>૭૮૪/</b> – અને રા. ૨૧૦૭૮૪/–	01-09-2023	
લોન નં.: SEJAMNR0202813 શાખા : જામનગર દેવાદાર : ૧. શ્રી દિલીપસંગ રાયસંગજી રાઠોડ ૨. શ્રીમતી ઇન્દુબા દિલીપસંગ રાઠોડ	આકરણીપત્રક ગામતલ હાઉસ નં. પદ/૧, રેસીડન્સીચલ હેતુસરની મિલકત, મોજે મુંગનાની, તાલુકો જામનગર, જિલો જામનગર, ખાતેની કુલ જમીન એરિસા ક્ષેત્રકળ પંo.૨૬ સો.મી (પક્ શે.કુટ) દારાવતી જમીન અને બિલ્ડીંગના તમામ ભાગ અને હિસ્સા તેમજે તના પરના તમામ વર્તમાન અને ભાવી સુપર સ્ટ્રુક્ચર્સ, ચતુઃસીમાઃ ઉત્તરઃ ભરતસિંહ રાઠોડનું ઘર, દક્ષિણઃ નરુભાચૌહાણનું ઘર, પુવઃપ્રતાપસિંહ કેરનું ઘર, પશ્ચિમઃપ્રવિણસિંહ ચૌહાણનું ઘર, કુલ જમીન ક્ષેત્રફળ પંo.૭૨ સો.મી. (પકદ્ સો.કુટ)સબ રજીસ્ટ્રેશન દિસ્ટ્રીક્ટ જામનગર, અને રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ જામનગર ખાતેની સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા	અને	01-09-2023	
લોન નં. : SEJAMNNR0232637 શાખા : જામનગર દેવાદાર : ૧. શ્રી મહાવીરસિંહ દેવુભા ચૌહાણ ૨. શ્રી દેવુભા ટપુભા ચૌહાણ ૩. શ્રીમતી ઇદરબા દેવુભા ચૌહાણ	ગામતલ મુંગનાની, પેટા જિલો મુંગનાની, જિલો જામનગર, ગુજરાત રાજ્ય ખાતેની ક્ષેત્રફળ ૩૨૭.૮૧ ચો.ક્રુટ (૫૩ ચો.મી) , ધરાવતી સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા અને તેના પરના તમામ વર્તમાન અને ભાવી સુપર સ્ટ્રક્ચર્સ. ચતુઃસીમાઃ ઉત્તરઃ પ્રવિણસિંહ રાયસંગજીનું ઘર, દક્ષિણઃ નરુભા રપુભાનું ઘર, પુર્વઃ વિજ્યસિંહ નાથુભાનું ઘર, પશ્ચિમઃ જિતુભા દોલુભાનું ઘર, ક્ષેત્રફળ ૩૨૭.૮૧ ચો.ક્રુટ, મિલકતના લોન એગ્રીમેન્ટ કમ ગીરો હેઠળ, સખ રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ જામનગર, અને રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ જામનગર ખાતેની સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા.	૨૭-૦૪-૨૦૨૩ અને રૂા. ૨૪૨૬૩૯/-	01-09-2023	
સ્થળ : ગુજરાત તારીખ : ૦૭.૦૯.૨૦૨૩	ઇક્વિટાસ સ્મો	અધિકૃત ાલ ફાચનાન્સ વ	ા અધિકારી, મેંક લીમીટેડ	

# જોલી પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ

(CIN:L70100GJ1981PLC004932) રજીસ્ટર્ડ ઓફીસ : ૧૧૦૭, અગિચારમો માળ, શિલ્પ એપીટોમ રાજ્યથ ક્લબ રોડ, બોડક્દેવ, અમદાવાદ-૩૮૦૦૫૪

### નોટીસ

જોલી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના સભ્યોની ૪૨મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) શુક્રવા૨ ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યે ૧૧૦૭, ૧૧મો માળ, શિલ્પ એપિટોમ રાજપથ કલ્બ રોડ, બોડકદેવ, અમદાવદા- ૩૮૦૦૫૪ ખાતે આ સભા બોલાવતી નોટીસમાં જણાવેલ કાર્યો પાર પાડવા માટે યોજાશે જે સભ્યો જેમના નામ શુક્રવાર, ૧ સપ્ટેમ્બર ,૨૦૨૩ ના રોજ રજીસ્ટરમાં નોંધાયેલ છે તેમને ૩૧ માર્ચ, ૨૦૨૩ ના રોજ પુરા થતાં વર્ષના વાર્ષિક અહેવાલ સાથે મોકલવામાં આવી છે.

કંપની કાયદા, ૨૦૧૩ (એક્ટ)ની કલમ ૯૧ મુજબ કંપનીના રજીસ્ટર ઓફ મેમ્બર્સ અને શેર ટ્રાન્સફર બુક્સ શુક્રવાર, ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ થી શુક્રવાર ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધી (બંને દિવસો સહીત) બંધ રહેશે. એક્ટની કલમ ૧૦૮ની જોગવાઇઓ અને કંપની (વ્યવસ્થાપન અને પ્રશાસન) નિયમો, ૨૦૧૪ના નિયમ ૨૦ અને સામાન્ય સભા અંગેના સેક્રેટરીયલ સ્ટાન્ડર્ડના સ્ટાન્ડર્ડ ૨ અન્વયે, કંપની તેમના સભ્યોને એજીએમની નોટીસમાં જણાવેલ ઠરાવો પર સીડીએસએએલ દ્વારા પુરી પડાયેલ ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા મત (રીમોટ ઇ-વોટીંગ)આપવાના તેમના હકનો ઉપયોગ કરવાની સવલત પુરી પાડી રહી છે.

- રીમોટ ઇ-વોટીંગની શરૂઆતની તારીખ અને સમયઃ
- મંગળવાર, ૨૬ સપ્ટેમ્બર ,૨૦૨૩ (સવારે ૯.૦૦ વાગ્યે) રીમોટ ઇ-વોટીંગ પુર્ણ થવાની તારીખ અને સમયઃ
- ગૂરૂવાર, ૨૮ સપ્ટેમ્બર ,૨૦૨૩ ( સાંજે ૫.૦૦ વાગ્યે) મત માટે લાયકાત નક્કી કરવાની કટ ઓફ તારીખઃ
- શક્રવાર.૧૫ સપ્ટેમ્બર .૨૦૨૩

તારીખ: ૦૬.૦૯.૨૦૨૩

સ્થળઃ રાજકોટ

- બેલોટ પેપર મારફત મતદાનની સવલત પણ એજીએમમાં હાજર રહેનાર સભ્યાને ઉપલબ્ધ કરાવામાં આવશે.
- જે સભ્યોએ રીમોટ ઇ-વોટીંગથી મત આપેલ છે તેઓ સભામાં પણ હાજર રહી શકે છે. પંરતુ સભામાં તેમના હકનો ઉપયોગ કરવા હકદાર ગણાશે નહી.
- એજાએમની નોટીસ કંપનીની વેબસાઇટ https://www.jollyplasticindustriesItd.in અને સીડીએસએલની વેબસાઇટ www.evotingindia.com ઉપર ઉપલબ્ધ છે.
- જો તમને ઇ-વોટીંગ સંબંધિત કોઇ પ્રશ્નો અથવા સમસ્યા હોય તો તમે હેલ્પ સેક્શન હેઠળ ઉપર ઉપલબ્ધ વારંવાર પુછાતા પ્રશ્નો www.evotingindia.com (એફએક્યુએસ) અને ઇ-વોટીંગ મેન્યુઅલ જોઇ શકો છો અથવા helpdesk.evoting@cdslindia.com ને ઇમેઇલ લખી શકો છો.

જોલી પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ વતી સહી/-બ્રજ મોહન સિંઘ મેનેજીંગ ડાયરે<del>ક્</del>ટર

**2જી.ઓફીસ :** ૧૪૦૧–૧૪૦૯, દલાલ સ્ટ્રીટ કોમર્સિચલ કો.ઓ. સોસાચટી લીમીટેડ, બ્લોક ૫૩ . (બિલ્ડીંગ નં. ૫૩ઇ), ઝોન–૫, રોડ–૫ઇ, ગિફ્ટ સિટી, ગાંધીનગર–૩૮૨૩૫૫, ગુજરાત **કોર્પો. ઓફીસ:** ૩૦૧–૩૦૮, ભગવતી હાઉસ, પ્લોટ નં. એ/૧૯, વીરા દેસાઇ રોડ, અંધેરી (પશ્ચિમ), મુંબઇ-૪૦૦૦૫૮ **ફોન** : ૯૧૨૨ ૨૬૭ ૩૨૬૦૨; **ફેક્સ** : ૯૧૨૨ ૨૬૭ ૩૨૬૪૨ वेजसाध्यः :www.dolatinvest.com धमेधलः investor@dolatalootech.in

દોલત એલ્ગોટેક લીમીટેડ

### CIN: L67100GJ1983PLC126089 ૪૨મી વાર્ષિક સામાન્ય સભાની નોટીસ, રીમોટ ઈ–વોટીંગ માહિતી અને બુક બંધ

પ્રાથી નોટીસ આપવામાં આવે છે કે કંપનીના સભ્યોની ૪૨મી વાર્ષિક સામાન્ય સભા (એજીએ: મથવા સભા) શુક્રવાર, ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ સાંજે ૪.૩૦ કલાકે વિડિયો કોન્ફરન્સીંગ વીસી)/ અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો (ઓએવીએમ) સવલત દ્વારા કંપનીની ૪૨ મી મેજીએમ બોલાવતી નોટીસમાં જણાવેલ કાર્ચો પાર પાડવા માટે ચોજાશે.

કંપની કાયદા, ૨૦૧૩ (એક્ટ)ની જોગવાઇઓ, સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડિસ્ક્લોઝ રીક્વાચરમેન્ટ્સ) નિયમનો, ૨૦૧૫ (સેબી લિસ્ટીંગ નિયમનો) અને એમસીએ પરિપત્રોન ખનુપાલન <mark>હે</mark>ઠળ કંનપીની એજીએમ વીસી/ઓએવીએમ મારફત ચોજાશે. કંનપીની રજીસ્ટર્ડ ઓફ્રીસ એજીએમનું સ્થળ માનવામાં આવશે.

લાગુ એમસીએ પરિપત્રો અને સેબી સરક્યુલર નં. SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 તારીપ ૦૫ જાન્યુઆરી, ૨૦૨૩ અનુસાર, નોટીસ તેમજ ૩૧ માર્ચ ,૨૦૨૩ના રોજપુરા થતાં નાણાંકિય વર્ષને વાર્ષિક અંહેવાલ જે સભ્યોના ઈમેઇલ એડ્રેસો કંપની/ડિપોઝીટરી/આરટીએમાંર જીસ્ટર્ડ છે તેમને પ્રમેઇલ થી મોકલેલ છે. સભ્યોએ નોંધ લેવી કે નોટીસ અને નાણાંકિય વર્ષ, ૨૦૨૨–૨૩નો વાર્ષિ: અહેવાલ કંપનીની વેબસાઇટ એટલે કે http://www.dolatalgotech.in, સ્ટોક એક્સરોન્જ એટલેકે બીએસઈ લીમીટેડની વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ રહેશે. નોટીસ ઈ–વોટીંગ સવલત પુરી પાડવા માટે નિમાચેલ એજન્સી એટલે કે નેશનલ સિક્ચોરીટીઝ ડિપોઝીટરી લીમીટેડ (એનએસડીએલ)ની વેબસાઇટ એટલે કે www.evoting.nsdl.com ઉપ૨ પણ ઉપલબ્ધ ૨હેશે.

કંપનીના ૨જીસ્ટર ઓફ મેમ્બર્સ અને શેર ટ્રાન્સફર બુક્સ શનિવાર, ૨૩ સપ્ટેમ્બર ,૨૦૨૩ થી શુક્રવાર, ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધી (બને દિવસો સહીત) એજીએમના હેતુસર બંધ રહેશે. કંપની કાયદા, ૨૦૧૩ની કલમ ૧૦૮ (એક્ટ) સાથે વંચાતા સંબંધિત નિયમો અને સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડિસક્લોઝર રીક્વાયરમેન્ટ્સ) નિયમનો, ૨૦૧૫ ના નિયમન ૪૪ અંતર્ગત કંપની સભ્યોને ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા મત આપવા માટેના તેમના હકનો ઉપયોગ કરવાની ૧વલત પુરી પાડતા આનંદ અનુભવે છે. એજીએમ પહેલા અને એજીએમ દરમિચાન રીમોટ છ વોટીંગ સવલતનો ઉપયોગ કરીને સભ્યોને મત આપવાની સવલત નેશનલ સિક્યોરીઝ ડિપોઝીટરી લીમીટેડ (એનએસડીએલ) પુરી પાડી રહી છે.

કંપનીએ રીમોટ ઇ-વોટીંગ અને એજીએમ દરમિયાન ઇવોટીંગની સવલત મેળવવા માટે હકદાર મભ્યો કંપનીની ભરપાઇ થયેલ ઇક્વીટી શેર મુડીમાં તેમના હિસ્સાના પ્રમાણમાં નક્કી કરવાની કટ ઓફ તારીખ તરીકે શુક્રવાર, ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ નિયત કરેલ છે. રીમોટ ઇ–વોટીંગ મંગળવાર, રદ્દ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ સવારે ૦૯.૦૦ વાગ્યે શરૂ થશે અને

ગુરુવાર, ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યે પુર્ણ થશે. ત્યારબાદ ઇ-વોટીંગ મોડ્યુલ એનએસડીએલ દ્વારા બંધ કરવામાં આવશે. જે સભ્યોએ એજીએમ પહેલા રીમોટ ઇ–વોટીંગથી ઠરાવો પર તેમના મત આપ્યા છે તેઓ

વીસી/ઓએવીએમ મારફત એજીએમમાં ભાગ લેવા માટે હક્દાર ગણાશે પંરતુ ફરીથી ઠરાવો પર તેમના મત આપવા માટે હકદાર ગણાશે નહી. એજુએમ પહેલા રીમોટ ઇ–વોટીંગ પ્રક્રિયા / એજુએમ દરમિયાન રીમોટ ઇ–વોટીંગ માટેની

વિગતવાર સુચના વાર્ષિક સામાન્ય સભાની નોટીસનો ભાગ બનતી નોંધોમાં આપેલ છે શેરહોલ્ડરોને વીસી/ઓએવીએમ મારફત એજીએમમાં હાજર રહેવાની સવલત પુરી પાડવામાં આવશે. વીસી/ઓએવીએમ દ્વારા સભામાં ભાગ લેવાની વિગતવાર પ્રક્રિયા વાર્ષિક સામાન ાભાની નોટીસનો ભાગ બનતી નોંધોમાં આપેલ છે.

એજીએમની નોટીસની રવાનગી પછી કંપનીના શેરો પ્રાપ્ત કરનાર અને કંપનીની સભ્ય બનના અને કટ ઓફ તારીખના રોજ શેરો ધરાવતી કોઇપણ વ્યક્તિ એજ<mark>ી</mark>એમની નોટીસમાં જણાવેલ સુચનાઓ મુજબ તેમના મત આપી શકે છે.

કોઇપણ પુછપરછ/સમસ્યા માટે તમે www.evoting.nsdl.com ના ડાઉનલોડ સેક્શન પર ઉપલબ્ધ ફ્રીકવન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ (એફએક્યુએસ) અને શેરહોલ્ડરોના ઈ-વોટીંગ યુઝર મેન્યુઅલ જોઈ શકો છો અથવા -૦૨૨-૪૮૮૬ ૭૦૦૦ અને ૦૨૨-૨૪૯૯ ૭૦૦૦ને કોલ કરવો અથવા evoting@nsdl.co.in ને અરજી મોકલવી. સભ્યો કંપનીને investor@dolatalgotech.in ઉપર પણ ઇમેઇલ મોકલી શકે છે. દોલત એલ્ગોટેક લીમીટેડ વતી સહી/-

સ્થળ : મુંબઇ તારીખ : ૦૬ સપ્ટેમ્બર ,૨૦૨૩

સંદિપકુમાર જી. ભાનુશાળી કંપની સેક્રેટરી અને કમ્પલાયન્સ ઓફીસર



ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સ કંપની લીમીટેડ **કોર્પોરેટ ઓફીસ** : ચોલા ક્રેસ્ટ, સુપર બી, સીપ૪, અને સીપ૫, ૪, થિરુ વી કા ઇન્ડસ્ટ્રીયલ

### ઈ–હરાજી વેચાણ નોટીસ (ફક્ત ઈ–બિડીંગ મારફત વેચાણ) સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮ એ ૯ હેઠળ સ્થાવર મિલકતોના વેચાણ માટે જાહેર જનતાને ઈ-હરાજી વેચાણ નોટીસ

આથી જાહેર જનતાને અને ખાસ કરીને કોલમ (એ)માં જણાવેલ દેવાદાર(રો) અને જામીનદાર(રો)ને નોટીસ આપવામાં આવે છે કે *નીચે કોલમ* સીમાં દર્શાવેલ સ્થાવર મિલકતો સિક્યોર્ડ લેણદારને ગીરો/ચાર્જડ કરાચેલ છે, જેનો ભૌતિક/પ્રત્યક્ષ કબજો ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ કાચનાન્સ કંપની લીમીટેડના અધિકૃત અધિકારીએ કોલમ (ડી) માં દર્શાવ્યા મુજબ લઈ લીધો છે, "જેનું જ્યાં છે", "જે છે' અને 'જેમ છે" ના ધોરણે, નીચે જણાવ્યા મુજબ

આથી સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્કોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮ (૬) હેઠળ કોલમ (એ) માં જણાવેલ દેવાદાર/ગીરવેદાર(રો)/કાનુની વારસદાર, કાનુની પ્રતિનિધિઓ (જાણમાં હોય અથવા જાણમાં ન હોય તેવા), સંબંધિત દેવાદાર(રો)/ ગીરવેદાર(રો) (અવસાન પછી) એક્ઝીક્યુંટર(રો), એડમિનિસ્ટ્રેટર(રો), સક્સેસ (રો) અને એસાઇનરોને અથવા પ્રસંગે નોટીસ આપવામાં આવે છે.

વેચાણની વિગતવાર શરતો અને નિચમો માટે, ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ અને ફાચનાન્સ કંપની લીમીટેડ, સિક્ચોર્ડ લેણદારની વેબસાઇટ એટલે રં https://www.cholamandalam.com અને www.auctionfocus.in પર આપેલ લિંક જોવા વિનંતી છે.

I		(એ)	(બી)	(સી)	(કી)	(ઇ અને એફ)	(প্ত)
	ક્રમ નં.	લોન એકાઉન્ટ નંબર, દેવાદાર(રો)/	વસુલાતની બાકી રકમ	રવાવર ભવકલ/સિક્લાંડ	કળજાનો પ્રકાર	રીઝર્વ કિંમત (રૂા.માં)	હરાજીની તારીખ અને
		ગીરવેદાર(રો)/ જામીનદાર(રો) ના નામ	(સિક્યોર્ડ ૠણ)	એસેટની વિગત	5 A	અર્નેસ્ટ મની ડિપોઝીટ (રૂા.માં)	સમય
ı		લોન એકા. નંબર :	<b>ફા.</b>	મિલકતનું ક્ષેત્રફળ ૫૫.દૃદ્ ચો.મી.,		३।. २૯,२०,६९७/-	૨૨.૦૯.૨૦૨૩
I		XL04AJR000029531	38,32,909/-	કોઠારિયા રેવન્યુ સર્વે નં. ૧૮૮ પૈકી ૨,		(રૂપિયા ઓગણત્રીસ	ના રોજ બપોરે <b>૨.૦૦</b>
1.		૧) જનક શૈલેષભાઇ મારુ	(રૂપિયા ચોત્રીસ	પૈકી સિલ્વ પાર્ક પૈકી, પ્લોટ નં. ૧૦૦		લાખ વીસ હજાર છસ્સો	વાગ્ <b>યા</b> થી
		૨) રિદ્ધિ મારુ તમામનું સરનામું : બ્લોક નં.	લાખ આડત્રીસ	ી (પ્લોટ ને. ૧૦૦ સિલ્વ પાર્ક, કોઠારિયા)		સત્તર પુરા)	8.00
		૧૦૩, વ્રજકટીર એપાર્ટમેન્ટ,		રાજકોટ, રાજકોટ ઝોન-૭, મુકામ-			<b>વાગ્યા</b> સુધી ( ટેન્ટર
	1.	સંજીવની હોસ્પિટલ પાસે,		રાજકોટ, તાલુકો-જિલો–રાજકોટ,		<b>₹</b> I.	દસ્તાવેજની
		રાજકોટ-૩૬૦૦૨૨ <b>અહીં પણ</b> :		રાજકોટ તાલુકો, રાજ્ય–ગુજરાત		२,૯२,०६९/-	શરતો મુજબ
		સિલ્વર પાર્ક, રેવન્યુ સર્વે નં.		ખાતેની બાંધકામ બિલ્ડ મિલકતના		(રૂપિયા બે લાખ બાણું	પ્રતિદિઠ પ મિનિટના
		૧૮૮ પૈકી ૨, પ્લોટ નં. ૧૦૦,	3.01	તમામ ભાગ અને હિસ્સા. <b>ચતુઃસીમા</b> :		હત્તર એકસઠ પુરા)	ામાનટના ઓટોમેટેડ
		રોડ નં. ૨, કોઠારિયા મેઇન		ઉત્તર : પ્લોટ નં. ૯૯, દક્ષિણ : કોમન			એક્સટેન્શ <b>ન</b>
ı		રોડ, કોઠારિયા–૩૬૦૦૦૩		પ્લોટ, પુર્વ : રોડ, પશ્ચિમ : પ્લોટ નં. ૯૦			ા સાથે)
H	- C.C 1						

૧. નિરિક્ષણની તારીખ અને સમય: ૨૦.૦૯.૨૦૨૩

૨. લઘુત્તમ બીડ વૃદ્ધિની રકમ: રૂા. ૧૦,૦૦૦/-

સ્થળ : રાજકોટ, ગુજરાત

3. બીડ/ઇએમડી/ ભાગીદારી માટે અરજી પત્ર જમી કરવાની છેલી તારીખ: ૨૧.૦૯.૨૦૨૩ ના રોજ સાંજે ૦૫.૦૦ વાગ્યા પહેલા ં તેમજ લોન એગ્રીમેન્ટની શરતો મુજબ લાગુ ચડત વ્યાજ તથા ચુકવણી અને/અથવા તેની વસુલાતની તારીખ સુધી કરાચેલ આકરિમક ખર્ચ,

મિલકતના નિરિક્ષણને સંબંધિત કોઇપણ મદદ માટે. અથવા બીડ દસ્તાવેજો મેળવવા માટે અને કોઇપણ અન્ય પછપરછ માટે ચોલા મંડલમ ઇન્વેસ્ટમેન્ટ અને ફાચનાન્સ કંપની લીમીટેડના અધિકૃત અધિકારીઓ **શ્રી ગીરીરાજસિંહ સી. ચુડારમા મોબાઇલ નં. <sup>૯</sup>૫૭૪૨ ૦૨૨૨૦ અને ઇમેઇલ** આઇડી girirajsinhsc@chola.murugappa.com / શ્રી મોહમ્મદ અબ્દુલ કાવીનો મોબાઇલ નં. ૭૩૦૫૯૯૦૮૭૨ નો સંપર્ક કરવો. ચોલા મંડલમ ઇન્વેસ્ટમેન્ટ અને ફાચનાન્સ કંપની લીમીટેડના અધિકૃત અધિકારીની શ્રેષ્ઠ જાણકારી અને માહિતી હેઠળ ઉપરોક્ત સ્થાવર મિલકતો/સિક્યોર્ડ

ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાચનાન્સ કંપની લીમીટેડ માટે

એસેટોના સંબંધમો કોઈ બોજો નથી. અધિકૃત અધિકારી તારીખ : ૦૫.૦૯.૨૦૨૩

ફોર્મ નં. આઈએનસી–૨૬

(કંપનીઝ (ઇનકોર્પોરેશન) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૩૦ ના અનુસંધાનમાં) રિજનલ ડાયરેકટર, ઉત્તર પશ્ચિમ રિજન, કોર્પોરેટ બાબતોના મંત્રાલય, આરઓસી ભવન, રૂપલ પાર્કસોસાયટી સામે, અંકુર બસ સ્ટોપની પાછળ, નારણપુરા, અમદાવાદ, ગુજરાત-૩૮૦૦૧૩

સમક્ષ કંપનીઝ એક્ટ, ૨૦૧૩, કંપનીઝ એક્ટ, ૨૦૧૩ ની કલમ ૧૩(૪) ની બાબતમાં

> અને કંપનીઝ (ઇનકોર્પોરેશન) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૩૦ (૫) (એ)

વેદાંતા, સામવેદ હોસ્પીટલ પાસે, કોમર્સ કોલેજ રોડ, નવરંગપુરા, અમદાવાદ–૩૮૦૦૦૯ ખાતે તેની રજીસ્ટર્ડ ઓફિસ ધરાવતા હેમાટો–ઓન્કોલોજી ક્લિનીક (અમદાવાદ) પ્રાઈવેટ લિમિટેડની

આથી જાહેર જનતાને સૂચના આપવામાં આવે છે કે અરજદાર કંપનીએ ૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રો૧ ગોલાવવમાં આવેલ વાર્ષિક જનરલ મીટીંગમાં પસાર કરાચેલ વિશેષ ઠરાવની શરતોમાં કંપનીની 20ીસ્ટર્ડ ઓફિસ ગુજરાત રાજ્ય થી મહારાષ્ટ્ર રાજ્યમાં બદલવા અરજદાર કંપનીના મેમોરેન્ડમ બોફ એસોસિએશનમાં ફેરફાર માટે બહાલી મેળવવા કંપની ઝએક્ટ, ૨૦૧૩ ની કલમ ૧૩(૪) હેઠળ કેન્દ્ર સરકારને અરજી કરવાની દરખાસ્ત કરી છે.

ભાવના છે તે કોઈપણ વ્યક્તિ તેમના/તેણીના હિતની પ્રકૃતિ અને વિરોધના આધાર દર્શાવતી ઝેફ્રિડેવિટ દ્વારા સમર્થિત તેમના/તેણીના વાંધાઓ આ નોટીસના પ્રકાશનની તારીખથી **૧**૪ દિવસોની અંદર અરજદાર કંપનીને નીચે જણાવેલા સરનામા ખાતે તેમની રજીસ્ટર્ડ ઓફિસે એક ાકલ મોકલવા સહિત સંબંધિત નામદાર રિજ્નલ ડાયરેકટર, ઉત્તર પશ્ચિમ રિજન, કોર્પોરેટ માબતોના મંત્રાલય, આરઓસી ભવન, રૂપલ પાર્ક સોસાયટી સામે, અંકુર બસ સ્ટોપની પાછળ નારણપુરા, અમદાવાદ, ગુજરાત-૩૮૦૦૧૩ ને પહોંચાડી શકે છે અથવા રજીસ્ટર્ડ પોસ્ટથી મોક્લી

**રજીસ્ટર્ડ ઓફિસ** : વેદાંતા, સામવેદ હોસ્પીટલ પાસે, કોમર્સ કોલેજ રોડ, નવરંગપુરા, અમદાવાદ-મે. હેમાટો–ઓન્કોલોજી ક્લિનીક (અમદાવાદ) ૩૮૦૦૦૯ ખાતે પ્રાઈવેટ લિમિટેડ માટે અને વતી

રાહી/-

ડૉ. ભાવીન શાહ

ડાયરેક્ટર

તારીખ : ૭મી સપ્ટેમ્બર, ૨૦૨૩

સાર્વજનિક જાહેરાત (ભારતીય દિવાલા અને શોધન અક્ષમતા બોર્ડ (ફડચા પ્રક્રિયા) નિયમનો, ૨૦૧૬ નો નિયમન ૧૨)

રામદેવ પીવીસી પ્રોડક્ટ પ્રાઇવેટ લીમીટેડના સ્ટેક્હોલ્ડરોની જાણકારી માટે ક્રમ નં. વિગતો

	3-1-1-1-1-1-1				
٩.	કોર્પોરેટ દેવાદારનું નામ	રામદેવ પીવીસી પ્રોડક્ટ પ્રાઇવેટ લીમીટેડ			
₹.	કોર્પોરેટ દેવાદારના સંસ્થાપનની તારીખ	30.06.2093			
з.	ઓથોરીટી જેના હેઠળ કોર્પોરેટ દેવાદાર સંસ્થાપિત / રજીસ્ટર્ડ છે	કંપની રજીસ્ટ્રાર- અમદાવાદ			
х.	કોર્પોરેટ દેવાદારનો કોર્પોરેટ ઓળખ નં./ લીમીટેડ લાયબીલીટી ઓળખ નં.	U25111GJ2013PTC077004			
ય.	કોર્પોરેટ દેવાદારની રજીસ્ટર્ડ ઓફીસ અને મુખ્ય ઓફીસ (જો કોઇ હોય તો) નું સરનામું	રજીસ્ટર્ડ ઓફીસ: સર્વે નં. ૭૩૬–૭૩૭, ગામ તરસાડી, તાલુકો માંગરોલ, જિક્ષો સુરત, ગુજરાત, સુરત, સુરત, ગુજરાત– ૩૯૪૪૧૦, ભારત			
٤.	ઇન્સોલ્વન્સી રીઝોલ્યુશન પ્રક્રિયાની સમાપ્તિની તારીખ	30.0८.२०२3			
9.	કોર્પોરેટ દેવાદારના ફડ્યાની શરૂઆતની તારીખ	૩૧.૦૮.૨૦૨૩ (આદેશની નકલ એનસીએલટીની વેબસાઈટ ઉપર ૦૪.૦૯.૨૦૨૩ના રોજ અપલોડ કરાઇ હતી)			
۷.	ફડચા અધિકારી તરીકે કાર્યરત ઇન્સોલ્વેન્સી પ્રોફેશનલનું નામ અને રજીસ્ટ્રેશન નંબર	શ્રી નવીન બ્રિજમોહન બઝારી IBBI/IPA001/IPP1312/2018-2019/12007			
૯. બોર્ડમાં	ફડ્યા અધિકારીનું સરનામું અને ઇમેઇલ રજીસ્ટર્ડ મુજબ	૪૦૧, સેન્ટર પોઇન્ટ, સીવીલ ચાર રસ્તા, નિર્મલ હોસ્પીટલ પાસે, સુરત, ગુજરાત-૩૯૫૦૦૨ ફડ્યા અધિકારીનો ઇમેઇલ : nbazarica@gmail.com			
	ફડયા અધિકારી સાથે પત્રવ્યવહાર માટેનું સરનામું અને ઇમેઇલ	એએએ ઇન્સોલ્વેન્સી પ્રોફેશનલ્સ એલએલપી ઈ-૧૦એ, કેલાશ કોલોની, પ્રેટર કેલાશ-૧, નવીદિલ્હી - ૧૧૦૦૪૮, પત્ર વ્યાહ્મ માટે ઇમેઇલ આઇડી cirp.ramdevpvc@gmail.com			
۹٩.	દાવાઓ જમા કરવાની છેક્ષી તારીખ	08.40.5053			
	0 0, 70 7 7 7 7				

ઝાથી અહીં નોટીસ આપવામાં આવે છે <del>કે</del> નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ, અમદાવાદ બેંન્ચ, અમદાવાદ દ્વાર ન્સોલ્વેન્સી અને બેંક્ટપ્ટસી કોડ, ૨૦૧૬ની કલમ ૩૩ હેઠળ ૩૧.૦૮.૨૦૨૩ ના રોજ રામદેવ પીવીસી પ્રોડક્ટ પ્રાઇવે લીમીટેડ ના ફડચાની શરૂઆતનો આદેશ આપવામાં આવ્યો છે. (આદેશની નકલ ૦૪.૦૯.૨૦૨૩ના રો એનએસએલટીની વેબસાઇટ ઉપર અપલોડ કરાઇ હતી.)

ઝાથી રામદેવ પીવીસી પ્રોડક્ટ પ્રાઇવેટ લીમીટેડ ના સ્ટેક્હોલ્ડરોને વિગત નં. ૧૦ સામે જણાવેલ સરનામાં પર ફડ્ચ અધિકારીને ૦૪.૧૦.૨૦૨૩ સુધી અથવા એ પહેલા સીઆઇઆરપી દરમિયાન તેમના દાવાઓ તેમજપુરાવા જમા <del>ક</del>રવ

નાણાંકિય ક્રેડીટરો ફક્ત ઇલેક્ટ્રીક માધ્યમો દ્વારા તેમના દાવાઓ તેમજ પુરાવા સુપરત કરી શકશે. અન્ય તમા ક્રેડીટરોએ તેના સંબંધિથ ફોર્મમાં જાતે, પોસ્ટ દ્વારા અથવા ઇલેક્ટ્રોનિક માધ્યમોથી દાવાઓ જમા કરી શકશે ાચત ફોર્મ https://ibbi.gov.in/downloadform.html ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. ખોટા કે ગેરમાર્ગે દોરતા દાવાના પુરાવાની સુપરતગી દંડને પાત્ર બનશે.

શ્રી નવીન બ્રિજમોહન બઝારી (ફડચા અધિકારી

રામદેવ પીવીસી પ્રોડક્ટ પ્રાઇવેટ લીમીટેડના મામલા

ਵਖ਼ ਕਾਂ.: IBBI/IPA001/IPP1312/2018-2019/12007

તારીખ: ૦૩.૦૬.૨૦૨૩ સ્થળ: નવી દિલ્હી

DCW

ડીસીડબલ્યુ લીમીટેડ CIN:L24110GJ1939PLC000748

**રજીસ્ટર્ડ ઓફીસ** : ધાંગધા – ૩૬૩ ૩૧૫, ગુજરાત **મુખ્ય ઓફીસ** : ત્રીજો માળ, નિર્મલ, નરીમાન પોઇન્ટ, મુંબઇ-૪૦૦ ૦૨૧ ફોન : ૦૨૨–૨૨૮૭૧૯૧૪, ફેક્સ : ૦૨૨–૨૨૦૨૮૮૩૯ વેબસાઇટ : www.dcwltd.com, ઇમેઇલ : legal@dcwltd.com

ચોર્ચાસીમી (૮૪મી) વાર્ષિક સામાન્ય સભાની નોટીસ અને ઈ–વોટીંગ માહિતી ઝાથી સભ્યોને જાણ કરવામાં આવે છે કે ડીસીડબલ્યુ લીમીટેડ (કંપની)ના સભ્યોની ચોર્યાસીમી (૮૪મી)

આવા તમ્લાગ માટા કરવાના આવે કે કારાકબાલ્યુ લાનાઠક (ક્યળા)ના સંભ્યાના ઘાવારાના (દેશના) વાર્ષિક સામાન્ય સભા શુક્રવાર, સ્ટ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યે વિકિયો કોન્ફ્કરન્સ (વીસી)/ અન્ય ઓડિયો વિઝચુઅલ માદયમો માટફત, એક જ સ્તૃતો સબ્યોની પ્રત્યક્ષ હાજરી વગર, કંનપી કાયદા, ૨૦૧૩ અને તે હેઠળ બનેલ નિયમોની લાગુ જોગવાઇઓ અને સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ફિસક્લોઝર રીક્લાચરમેન્ટ્શ) નિયમનો, ૨૦૧૫ (લિસ્ટીંગ નિયમનો)ના અનુપાલન હેરળ અને કોર્પોરેટ અફર્સ મંત્રાલય દારા જારી કરાશેલ જનરલ સરક્શલર નં. ૨૦/૨૦૨૦ તારીખ ૫ મે, ૨૦૨૦ સાથે વંચાતા જનરલ સરક્યુલર નં. ૧૪/૨૦૨૦ તારીખ ૮ એપ્રિલ, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૧૭/૨૦૨૦ તારીખ ૧૩ એપ્રિલ, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૨/૨૦૨૧ તારીખ ૧૩ જાન્યુંઆરી, ૨૦૨૧, જનરલ સરક્યુલર નં. ૨/૨૦૨૨ તારીખ ૫ મે, ૨૦૨૨ અને જનરલ સરક્યુલર નં. ૧૦/૨૦૨૨ તારીખ ૨૮ ડિસેમ્બર. ૨૦૨૨ (સંચક્ત રીતે એમસીએ પરિપત્રો તરીકે દર્શાવેલ છે) મારક્ત અને સિક્ચોરીટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ તેના સરક્યુલર નં. SEBI/HO/CFD/PoD અનુપાલન હેઠળ નોટીસ તારીખ ૧૪ ઓગસ્ટ, ૨૦૨૩માં જ્યાવેલ કાર્યો પાર પાડવા માટે યોજાશે એ <sup>4</sup>મરીએ પરિપત્રો અને સેબી પરિપત્રો અનુસાર, એંજીએમમાં પાર પાડવાના સામાન્ય અને ખાસ કામકાજો જણાવવતી એજીએમની નોટીસ અને તેના ખુલાસા નિવદન તેમજ 3૧ માર્ચ, ૨૦૨૩ના રોજ પુરા થતાં નાણાંકિચ વર્ષના કંપનીના વાર્ષિક અહેવાલની સાથે સાથે ૩૧ માર્ચ ,૨૦૨૩ના રોજ પુરા થતાં નાણાંકિચ વર્ષના કંપનીના નાણાંકિય નિવેદનો અને તેના પરનો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને ઓડિટર્સનો અહેવાલ જે સભ્યોના ઇ-મેઇલ એડેસ ડિપોઝીટરી પાર્ટીશીપન્ટ(ટો)/કંપની/બિગશેર સર્વિસીઝ પ્રાઇવેટ લીમીટેડ (૨જીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફેર એજન્ટ)(આરટીએ)પાસે રજીસ્ટર્ડ છે અને આ હેતુસરની કટઓફ તારીખ શુક્રવાર, ૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ કંપનીના શેરહોલડીંગ ધરાવતા સભ્યોને બુધવાર, ૬ સપ્ટેમ્બર . ૦૨૩ના રોજઇલેક્ટ્રોનિકલી મોકલેલ છે. ઉપરોક્ત પરિપત્રો અંતર્ગત કંપની કોઇપણ સભ્યને એજીએમની નોટીસ અને નાગોંક્સિય વર્ષ ૨૦૨૨–૨૩ના વાર્ષિક અઢેવાલન કીઝીકલ નકલો મોકલગે નઢી એબ્રુએમની નોટીસ અને વાર્ષિક અહેવાની નકલ કંપનીની વેબસાઇટ https:/dcwltd.com/wp content/uploads/2023/09/DCW-Annual-Report-2022-23 pdf અને સ્ટોક એક્સરોજોની ઝસાઇટ www.bseindia.com અને www.nseindia.com અને નેશનલ સિક્ચોરીટીઝ ડિપોઝીટરી લીમીટેડ (એનએસડીએલ)ની વેબસાઇટ https://evoting.nsdl.com ઉપર પણ ઉપલબ્ધ ૨હેશે. કંપનીએ જો આગામી એજીએમમાં સભ્યો દ્વારા દોષણા કરવામાં આવે તો, ૩૧ માર્ચ, ૨૦૨૩ના રોજ પુરા થતાં નાણાંકિય વર્ષ માટે રૂ. ૨/–ની મુળ ફિંમતના શેર દીઠ રૂ. ૦.૩૦ (ત્રીસ પૈસા) ના સુચિત ડિવિડન્ડ મેળવવા માટે હકદાર સભ્યો નક્કી કરવાની રેકોર્ડ તારીખ તરીકે શુક્રવાર, ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ નિયત

રાભ્યોએ નોંધ લેવી કે કંપનીના રજીસ્ટર ઓફ મેમ્બર્સઅને શેર ટ્રાન્સફર બુક્સ શનિવાર, ર3 સપ્ટેમ્બર ,૨૦૨૩ થી શુક્રવાર, ર૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધી (બંને દિવસો સહીત) બંધ રહેશે. એક્ટની કલમ ૧૦૮૦ ભે જોગવાઇઓ સાથે વંચાતા કંપની (વ્યવસ્થાપન અને પ્રશાસન) નિયમો, ૨૦૧૪ના

નિરામન ૨૦ અને વિસ્ટીંગ નિરામનોના નિરામન xx અંતર્ગત સભ્યોને નેશનલ સિક્સોરીટીંગ ડિપોઝીટરી લીમીટેડ (એનએસડીએલ) ના પ્લેટફોર્મના ઇલેક્ટ્રોનિક વોટીંગ (રીમોટ ઇ–વોટીંગ) મારફ્ત અને એજાએમમાં ઈ–વોટીંગ મારકત પણ આ નોટીસમાં

-વોટીંગ મંગળવાર, રદ્દે સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ સવારે ૯.૦૦ વાગ્યે શરૂ થશે અને ગુરુવાર **૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ સાંજે ૫.૦૦ વાગ્ચે પૂર્ણ થશે** અને ત્યારબાદ રીમોટ ઇ–વોટીંગ મોડ્યુલ બંધ/બ્લોક કરવામાં આવશે. જણાવેલ તારીખ અને સમય પછી રીમોટ ઇ–વોટીંગની પરવાનગી મળશે નહી. એજાએમની નોટીસમાં જણાવેલ ઠરાવ પર રીમોટ ઈ–વોટીંગ મારકત સભ્યએ એક વખત મત આપ્યા પછી, સભ્યને ફરીથી તેમાં ફેરફાર કરવાની પરવાનગી મળશે નહી અને રીમોટ ઇ–વોટીંગથી અપાચેલ આવા મત અંતિમ ગણાશે.

જેઓ તેમ કરવા પ્રતિબંધિત નથી. તેઓ એજાએમ દરમિયાન ઇલેક્ટોનિકલી તેમના મત આપવા હકદાર ગણાશે. સભ્યો રીમોટ ઇ–વોટીંગ મારફત મત આપવાના તેમના હકનો ઉપયોગ કર્યા પછી પણ એજીએમમ ભાગ લઈ શકે છે પરંતુ એજીએમ દરમિયાન ફીથી મત આપવાની મંજુરી મળશે નહી. જે વ્યક્તિનું નામ શુક્રવાર, ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ (કટ ઓફતારીખ) ના રોજ રજીસ્ટર ઓફ મેમ્બર્સ અને ડિપોઝીટરીઓ દ્વારા સંચાલિત લાભાર્થી માલિકોના રજાસ્ટરમાં નોંધાચેલ છે કક્ત તેઓજ રીમોટ ઈ–વોટીંગ અથવા એજાએમ્ દરમિયાન ઈ-વોટીંગ મારફત મત આપવા હકદારદ ગણાશે. સભ્યોના મતદાન હકો કટ-ઓફ તારીખ એટલે કે શક્રવાર. ૨૨ સપ્ટેમ્બર. ૨૦૨૩ના રોજ કંપનીની ભરપાઇ થયેલ ઇક્વિટી શેર મડીમાં તેમના હિસ્સાના પ્રમાણમાં રહેશે. કટઓફ તારીખના રોજ સભ્ય ન હોય તેવી વ્યક્તિએ આ નોટીસને ફક્ત જાણકારીના હેતુસર લેવાની રહેશે.

છો<sub>.</sub> છે. છે. છે. છે. કેપનીના શેરો પ્રાપ્ત કરનાર અને કંપનીની સભ્ય બનનાર અને કટ ઓક તારીખના રોજ શેરહોલ્ડીંગ ધરાવતી કોઇપણ વ્યક્તિ જો તેઓ પહેલેથી ઈ-વોટીંગ માટે એનએસડીએલમાં રજીસ્ટર્ડ છે તો તેમન ચાલુ યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી શકે છે અથવા એજીએમની નોટીસમાં જણાવેલ વિગતવાર પ્રેકિંચા અનુસરવી અથવા evoting@nsdl.co.in ને અરજી મોકલીને યુઝર આઇડી અને પાસવર્ડ મેળવી શકે છે અથવા ટોલ ફ્રી નં. ૦૨૨–૨૪૯૯ ૭૦૦૦ અને ૦૨૨ ૪૮૮૬ ૭૦૦૦ ને કોલ કરવો.

ડિમટીરીચલાઇઝડ સ્વરૂપે, ફીઝીકલ સ્વરૂપે શેરહોલ્ડીંગ ધરાવતા સભ્યો માટે અને જેસભ્યોએ તેમના ઇમેઇલ એડ્રેસ રજીસ્ટર્ડ કરાવેલ નથી તેવા સભ્યો માટે રીમોટ ઈ–વોટીંગ અથવા એજીએણ દરયિમાન ઇ વોટીંગ મારેફત મત આપવાની રીત એજીએમની નોટીસમાં આપેલ છે.

જે સભ્યોએ તેમના ઇ-મેઇલ એડ્રેસી સ્ઝાસ્ટર્ડ કરાવેલ નથી તેઓને ડિમટીરીચલાઇઝડ સ્વરૂપે શેરહોર્લ્ડીંગના સંબંધમાં તેમના સંબંધિત ડિપોઝીટરી પાર્ટીશીપન્ટ પાસે અને ફીઝીકલ સ્વરૂપે શેરહોલ્ડીંગના સંબંધમાં કંપનીના આરટીએને ઇમેઇલ એડ્રેસ મોબાઇલ નંબર, પાનકાર્ડની સ્વ પ્રમાણીત નકલ અને શેર સર્ટીફોકેટની નકલ પુરી પાડતા અરજી પત્રની સહી કરેલ સ્કેન્ડ નકલ ધરાવતી અરજી ઇમેઇલ કરીને અથવા એજીએમની નોટીસમાં જણાવેલ પ્રક્રિયા અનુસરીને તે રહજીસ્ટર્ડ કરાવા વિનંતી છે. સભ્યોને એનએસડીએલ દ્ભૂરા પુરા પડાયેલ ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ મારફત ઐજિએમમાં હાજર રહેવાની સવલત પરી પાડવામાં આવી છે.

સભ્યોને https://www.evoting.nsdl.com ની મુલાકાત લઈને તેમને અપાયેલ રીમોટ ઇ–વોટીંગ વિગતોનો ઉપયોગ કરીને શેરહોલ્ડરો/સભ્યોના લોગીનમાં પ્રવેશ કરવા વિનંતી છે.

કોઇપણ પુછપરછ માટે, તમે www.evoting.nsdl.com ના ડાઉનલોડ સેક્શનમાં ઉપલબ્ધ શેરહોલ્ડરો માટેના ક્રીકવન્ટલી આસ્ક્ક ક્વેશ્વન્સ (એક્એક્યુએસ) અને ઇ-વોટીંગ યુઝર મેન્યુઅલ જોવા વિનંતી છે અથવા ટોલફી નં. ૦૨૨– ૨૪૯૯ ૭૦૦૦ અને ૦૨૨– ૪૮૮૬ ૭૦૦૦ ને કોલ ક્ટવો અથવા શ્રી અનુભવ સક્સેનાને evoting@nscl.co.in ઉપર અરજી મોકલવી.

કેવાયસી વિગતો સુધરાવવી

સભ્યોએ નોંધ લેવી કે સેળી સરક્યુલર નં. SEBI/HO/MIRSD/MIRSD-PoD-1/P/CIR/2023/37 તારીખ ૧૬ માર્ચ, ૨૦૨૩ મુજબ, લિસ્ટેડ સંસ્થાઓમાં ફીઝીકલ સિક્ચોરીઝ ના તમામ હોલ્ડરો માટે પાન, સરનામું, ઇમેઇલ આઇડી, બેંક એકાઉન્ટ વિગતો (કેવાચરી વિગતો) અને શ્રેરહોલ્ડરોની નોમીનેશન વિગતો જેમણે રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ (આરટીએ) માં સુધારવેલ નથી તેમના માટે તે સુધરાવવી ફરજિયાત છે. પરિણામે કંપનીના આરટીએ એટલે કે બિગ શેર સર્વિસીઝ પ્રા.લી. રેકોર્ડમાં ઉપરોક્ત વિગતો સુધરાવ્યાપછી જટ્રાન્સમીશન, ડિવિડન્ડ વગેરેના સંબંધમાં શેરહોલ્ડરોની તમામ સર્વિસ મરજીઓ સ્વીકારણે. જો ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજઅથવા એ પહેલા ફોલિયો નંબરમાં જો કોઇ કેવાચસી વિગતો સુધરાવેલ નથી, તો આવા ફોલિયો ઉપરોક્ત સેબી સરક્યુલર મુજબ ૧ ઓક્ટોબર, ૨૦૨૩ થી મારટીએ દ્વારા ફ્રોઝન કરવામાં આવશે. ડીસીડબલ્યુ લીમીટેડ વતી

સ્થળ: દ્યાંગદ્યા તારીખ: ૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૩

દિલિય દરજી સીનીચર જનરલ મેનેજર (લીગલ) અને કંપની સેક્રેટરી

સહી/-

એસીએસ–૨૨૫૨૭